



Established by Late Shri Rasikbhai G. Shah & Managed by Ahmedabad Kelavani Trust

# Ahmedabad Arts & Commerce College

(Accredited by NAAC & Affiliated to Gujarat University)

Near Telephone Exchange, Vasna, Ahmedabad – 380 007.

Code No.: 008

Uni. Code No. 065

UGC recognized 2(f) & 12(B)

Tel No.: 079-26605559

E-mail: aacc065@gmail.com

Website: www.aacc.edu.in

Date:

## **NOTICE REGARDING ASSIGNMENT SUBMISSION**

### **BA / BCOM SEM-1, 3, 5**

### **MA / MCOM SEM 1, 3**

1. BA/BCOM/MA/MCOM ના વિદ્યાર્થીઓએ તમામ વિષયો માટે અસાઈનમેન્ટ ફરજિયાતપણે OFFLINE મોડમાં submit કરવાના રહેશે.
2. અસાઈનમેન્ટ ફરજિયાતપણે A4 સાઈઝ ના પેપર્સમાં પોતાના જ હસ્તાક્ષર મા લખવાના રહેશે.
3. પ્રથમ પેજનો નમૂનો (પેજ નંબર ૨) નીચે આપેલ છે જેની પ્રિન્ટ-આઉટ લઈને અસાઈનમેન્ટની સાથે જોડવાની રહેશે,
4. બીજા પેજ પર INDEX નો નમૂનો (પેજ નંબર ૩) નીચે આપેલો છે એની પ્રિન્ટ આઉટ લઈને જોડવાની રહેશે,
5. ત્રીજા પેજ પર સર્ટિફિકેટ નો નમૂનો (પેજ નંબર ૪) નીચે આપેલો છે એની પ્રિન્ટ આઉટ લઈને જોડવાની રહેશે.
6. દરેક પેજ પર વિદ્યાર્થીએ પોતાનું નામ, રોલ નંબર અને સિગ્નેચર કરવાની રહેશે. પ્રત્યેક પેપરના અસાઈનમેન્ટની આગળ પેજ નંબર ૨, ૩ અને ૪ પુરેપુરી વિગતો ભરીને જોડવાના રહેશે.
7. દરેક પેજ નીચે પેજ નંબર આપવો જરૂરી છે.
8. અસાઈનમેન્ટ સબમીટ કરવું ફરજિયાત છે જેની નોંધ લેવી.
9. અસાઈનમેન્ટ સબમિશન અંગે નો વિગત વાર કાર્યક્રમ પછી થી જાહેર કરવામાં આવશે.



Established by Late Shri Rasikbhai G. Shah & Managed by Ahmedabad Kelavani Trust

# Ahmedabad Arts & Commerce College

(Accredited by NAAC & Affiliated to Gujarat University)

Near Telephone Exchange, Vasna, Ahmedabad – 380 007.

Code No.: 008

Uni. Code No. 065

UGC recognized 2(f) & 12(B)

Tel No.: 079-26605559

E-mail: aacc065@gmail.com

Website: www.aacc.edu.in

---

## **DETAILS OF THE STUDENT FOR ASSIGNMENT SUBMISSION**

NAME OF THE STUDENT: \_\_\_\_\_

STREAM (BA/BCOM/MA/MCOM): \_\_\_\_\_

SEMESTER: \_\_\_\_\_

ROLL NUMBER: \_\_\_\_\_

SUBJECT: \_\_\_\_\_

PAPER CODE: \_\_\_\_\_

PAPER NAME: \_\_\_\_\_

SIGNATURE OF THE STUDENT: \_\_\_\_\_



Established by Late Shri Rasikbhai G. Shah & Managed by Ahmedabad Kelavani Trust

# Ahmedabad Arts & Commerce College

(Accredited by NAAC & Affiliated to Gujarat University)

Near Telephone Exchange, Vasna, Ahmedabad – 380 007.

Code No.: 008

Uni. Code No. 065

UGC recognized 2(f) & 12(B)

Tel No.: 079-26605559

E-mail: aacc065@gmail.com

Website: www.aacc.edu.in

## INDEX

| SR. NO. | CONTENT | PAGE NO. |
|---------|---------|----------|
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |
|         |         |          |



Established by Late Shri Rasikbhai G. Shah & Managed by Ahmedabad Kelavani Trust

# Ahmedabad Arts & Commerce College

(Accredited by NAAC & Affiliated to Gujarat University)

Near Telephone Exchange, Vasna, Ahmedabad – 380 007.

Code No.: 008

Uni. Code No. 065

UGC recognized 2(f) & 12(B)

Tel No.: 079-26605559

E-mail: aacc065@gmail.com

Website: www.aacc.edu.in

## CERTIFICATE OF ASSIGNMENT SUBMISSION

Mr./Miss \_\_\_\_\_

Roll Number \_\_\_\_\_ has successfully submitted assignment of

Stream & Semester \_\_\_\_\_

Subject \_\_\_\_\_

Date \_\_\_\_\_.

Name of the Faculty \_\_\_\_\_

Signature of the Faculty \_\_\_\_\_

# Ahmedabad Arts and Commerce College

## Assignment

### BCOM Semester 3

Subject Code: DSC-C-231

Subject Name: Cost Accounting-1

English Medium

=====

**Que-1 (A)** Explain the advantages and limitations of cost accounting

**(B)** From the following information, calculate:

- (a) Re- order Stock level
  - (b) Minimum Stock level
  - (c) Maximum Stock level
  - (d) Average Stock level
  - (e) Danger Stock level
- |                                                   |           |
|---------------------------------------------------|-----------|
| 1. Maximum delivery period                        | 45 days   |
| 2. Average delivery period                        | 35 days   |
| 3. Minimum delivery period                        | 25 days   |
| 4. Maximum delivery period for emergency purchase | 5 days    |
| 5. Maximum rate of consumption per day            | 30 units  |
| 6. Average rate of consumption per day            | 25 units  |
| 7. Minimum rate of consumption per day            | 20 units  |
| 8. Ordering Quantity                              | 600 units |

**OR**

**Que-1** On 1<sup>st</sup> November 2025, A Ltd has 10000 DVDs in stock at rs.100. during the month they purchased as under:

November 8: 4000 DVDs at Rs. 125 per DVD

November 15: 6000 DVDs at Rs. 150 per DVD

November 22: 8000 DVDs at Rs. 165 per DVD

For producing they supplied as under:

November 16: 16000 DVDs

November 30: 10000 DVDs

What is the closing stock value if

- 1. FIFO Method
- 2. Weighted average method is applied?

**Que-2 (A)** Give the difference between Direct Wages and Indirect Wages?

**(B)** In a factory wages are paid as per Halsey Plan. The following information is available for the work of a worker:

- 1. Time saved 25 hours.
  - 2. Bonus to workers is 10% of time wages.
  - 3. Materials used per unit Rs.350.
  - 4. Factory overhead are 20% of prime cost.
  - 5. Factory cost per unit is Rs.1212.
- Find out the time allowed to complete the work.

**OR**

**Que-2** Calculate the normal and overtime wages payable to a workman from following data:

| Days    | Hours Worked |
|---------|--------------|
| Monday  | 9            |
| Tuesday | 11           |

|           |    |
|-----------|----|
| Wednesday | 10 |
| Thursday  | 9  |
| Friday    | 9  |
| Saturday  | 5  |
| Total     | 53 |

Normal working hours: 8 hours per day

Normal rate: Rs. 10 per hour

Overtime rate:

Up to 9 hours in a day at single rate and over 9 hours in a day at double rate OR

Up to 48 hours in a week at single rate and over 48 hours at double rate, whichever is more beneficial to the workmen.

**Que-3 (A)** Write a short note on Over-absorption and under-absorption of overheads.

**(B)** In a company there are three production department H, N and G and two service departments A and B. The details of expenses during March, 2024 are as under:

|                          | Rs.    |
|--------------------------|--------|
| Rent and Rates           | 10,000 |
| General Lighting         | 1,200  |
| Indirect Wages           | 3,000  |
| Power                    | 3,000  |
| Depreciation on machines | 20,000 |
| Sundries                 | 20,000 |

**(1) Other Information:**

| Particulars              | H      | N      | G      | A     | B     |
|--------------------------|--------|--------|--------|-------|-------|
| Floor space used(sq.met) | 2,000  | 2,500  | 3,000  | 2,000 | 500   |
| Lighting points (Nos.)   | 20     | 30     | 40     | 20    | 10    |
| Direct Wages (Rs)        | 6,000  | 4,000  | 6,000  | 3,000 | 1,000 |
| Horse power of machine   | 120    | 60     | 100    | 20    | -     |
| Cost of machine (Rs)     | 24,000 | 32,000 | 40,000 | 2,000 | 2,000 |
| Production hours         | 4,670  | 3,020  | 3,050  | -     | -     |

**(2) Service department expenses allocation:**

| Particulars     | H   | N   | G   | A   | B   |
|-----------------|-----|-----|-----|-----|-----|
| Service Dept. A | 20% | 30% | 40% | -   | 10% |
| Service Dept. B | 40% | 20% | 30% | 10% | -   |

**You are required to prepare (1) A statement showing distribution of overhead expenses and (2) A statement showing allocation of expenses of service department to production department**

**OR**

**Que-3** Bharat Company is having four departments: A, B and C are producing departments and D is a service department. The actual cost for a period of one month are as under:

|                            |      |
|----------------------------|------|
| Indirect expenses          | 1000 |
| Rent                       | 2200 |
| Plant Repairs              | 1200 |
| Depreciation               | 900  |
| Lighting                   | 220  |
| Supervision expenses       | 3000 |
| Insurance premium of plant | 1000 |
| Power                      | 1800 |

**Other Information:**

| Particulars             | A   | B   | C   | D  |
|-------------------------|-----|-----|-----|----|
| Area occupied – sq. ft. | 250 | 150 | 100 | 50 |

|                         |       |       |       |      |
|-------------------------|-------|-------|-------|------|
| Number of workers       | 24    | 16    | 12    | 8    |
| Value of plant (Rs.)    | 24000 | 18000 | 12000 | 6000 |
| Direct wages (Rs.)      | 8000  | 6000  | 4000  | 2000 |
| Actual power used (Rs.) | 800   | 400   | 400   | 200  |

Apportion the costs to the various departments on the suitable basis.

**Que-4 (A)** What is tender and how is tender price determined?

**(B)** Costing department of L&T Company Ltd. Gives you following information. Prepare a cost sheet.

|                                                                   |        |
|-------------------------------------------------------------------|--------|
| Material cost will be                                             | 24,000 |
| Direct wages will be                                              | 16,000 |
| Works overheads will be 50% of direct wages.                      |        |
| Unsold stock of finished goods will be 10% of factory cost.       |        |
| Selling and Distribution overheads will be the same of wages cost |        |
| Sales Price                                                       | 80,000 |
| Profit will be 10% of sales price                                 |        |
| Office overhead expenses will be 16% of sales price.              |        |

**OR**

**Que-4** Tushar Clock Manufacturing Company manufactured and sold 5,000 clocks at its 50% production capacity in the year 2025. The following is the cost per unit:

| Particulars                     | Rs.        |
|---------------------------------|------------|
| Direct Materials                | 100        |
| Direct Wages                    | 50         |
| <b>Prime Cost</b>               | <b>150</b> |
| Factory Overheads:              |            |
| - Fixed                         | 10         |
| - Variable                      | 20         |
| <b>Factory Cost</b>             | <b>180</b> |
| Office Overheads (Fixed)        | 20         |
| <b>Total Cost of Production</b> | <b>200</b> |
| Sales Overheads:                |            |
| - Fixed                         | 40         |
| - Variable                      | 10         |
| <b>Total Cost</b>               | <b>250</b> |
| Profit                          | 50         |
| Sales Price                     | 300        |

For the year 2026, it is estimated that:

1. The production will be at its full production capacity, of which 80% units will be sold.
2. Cost of materials and wages will increase by 20%.
3. The rate of profit on cost remains the same as per last year.

From the above information, prepare a statement of total cost and estimated profit for the year 2026.

**Que-5(1)** Which one of the following is not a Costing Method?

- (a) Marginal Costing                      (b) Job Costing  
(c) Batch Costing                          (d) Contract Costing

**(2)** Which one of the following is a Product Cost?

- (a) Indirect Materials                      (b) Administrative Staff Salary  
(c) Salesman's Commission              (d) Interest on Bank Loan

**(3)** Out of the following which wage system is not treated as an Individual incentive wage system?

- (a) Bedeaux plan                              (b) Taylor's differential wage system  
(c) Merrick's multiple rate system      (d) Co-partnership

- (4) Basis of overheads apportionment for plant repairing is?  
(a) Space Occupied (b) Value of Plant  
(c) Plant Hours (d) Depreciation on Plant
- (5) Cost of sales is Rs 1,80,000, amount of profit is Rs. 20,000, state the percentage of profit on sales?  
(a) 11% (b) 10%  
(c) 12% (d) 9%
- (6) Which costing method is used in Gas Supplier company?  
(a) Operating Costing (b) Process Costing  
(c) Batch Costing (d) Job Costing
- (7) If opening stock is Rs. 12000, purchases Rs. 24000 and closing stock is Rs. 4000, what would be material turnover rate?  
(a) 4 Times (b) 5 Time  
(c) 7 Times (d) 3.5 Times
- (8) If management is efficient, labour turnover rate can be  
(a) Increase (b) Can make zero  
(c) No effect (d) Can reduce
- (9) Basis of apportionment for Indirect labour is?  
(a) Direct labour ratio (b) No of workers ratio  
(c) Labour hour ratio (d) As per machine hour rate
- (10) Cost of sales is Rs. 270000, amount of profit is Rs. 30000. state the percentage of profit on sales?  
(a) 10% (b) 11%  
(c) 15% (d) 9%

**Ahmedabad Arts and Commerce College**

**Assignment**

**BCOM Semester 3**

**Subject Code: DSC-C-231**

**Subject Name: Cost Accounting-1**

**Gujarati Medium**

પ્રશ્ન-1 (અ)પડતર હિસાબોના ફાયદા અને ગેરફાયદા સમજાવો?

(બ) નીચે આપેલી માહિતી પરથી:

(a) પુનઃ વરદી સપાટી

(b) લઘુત્તમ સપાટી

(c) ગુરુત્તમ સપાટી

(d) સરેરાશ સપાટી અને

(e) ભય સપાટી ની ગણતરી કરો.

|                                         |          |
|-----------------------------------------|----------|
| 1. માલ મેળવતા લાગતો વધુમાવધુ સમય        | ૪૫ દિવસ  |
| 2. માલ મેળવતા લાગતો સરેરાશ સમય          | ૩૫ દિવસ  |
| 3. માલ મેળવતા લાગતો ઓછામાં ઓછો સમય      | ૨૫ દિવસ  |
| 4. તાત્કાલિક ખરીદી મેળવવા લાગતો વધુ સમય | ૫ દિવસ   |
| 5. એક દિવસનો વધુમા વધુ વપરાશ નો દર      | ૩૦ એકમો  |
| 6. એક દિવસનો સરેરાશ વપરાશ નો દર         | ૨૫ એકમો  |
| 7. એક દિવસનો ઓછામાં ઓછો વપરાશ નો દર     | ૨૦ એકમો  |
| 8. વરદી જથ્થો                           | ૬૦૦ એકમો |

**અથવા**

પ્રશ્ન-1 1 લી નવેમ્બર 2025 ના રોજ અ લિમિટેડ પાસે 10000 DVDs નો સ્ટોક રૂ.100 લેખે હતો. તે માસ દરમિયાન તેની ખરીદી નીચે પ્રમાણે હતી:

નવેમ્બર 8: 4000 DVDs રૂ . 125 દર DVD લેખે

નવેમ્બર 15: 6000 DVDs રૂ . 150દર DVD લેખે

નવેમ્બર 22: 8000DVDs રૂ . 165 દર DVD લેખે

ઉત્પાદન માટે પૂરો પાડેલ માલ નીચે પ્રમાણે હતો:

નવેમ્બર16: 16000 DVD

નવેમ્બર 30: 10000 DVD

આખરસ્ટોક ની કિંમત કેટલી રહેશે?

1. ફિફ્ટી પદ્ધતિ

2. ભારીત સરેરાશની પદ્ધતિ ?

પ્રશ્ન-2 (અ) પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરી વચ્ચે તફાવત આપો?

(બ) એક કારખાનામાં હેલ્સી યોજના મુજબ વેતન ચૂકવાય છે. એક કામદારે કરેલ કાર્ય અંગે નીચેની માહિતી મળે છે:

1. બચાવેલ સમય ૨૫ કલાક.
2. કામદારના બોનસની રકમ સમય વેતનના ૧૦% છે.
3. એકમદીઠ વસ્તુમાં વપરાતો માલસામાન રૂ ૩૫૦.
4. કારખાના ના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના ૨૦% છે.
5. એકમદીઠ કારખાના પડતર ૧૨૧૨ છે.

ઉપરની માહિતી પરથી કાર્ય પૂરું કરવા માટે આપેલ સમય શોધો.

અથવા

પ્રશ્ન-2નીચેઆપેલી માહિતી પરથી કામદારને ચૂકવવાનુસામાન્ય વેતન અનેઓવરટાઇમ વેતનની ગણતરીકરો:

| દિવસો    | કામના કલાકો |
|----------|-------------|
| સોમવાર   | 9           |
| મંગળવાર  | 11          |
| બુધવાર   | 10          |
| ગુરુવાર  | 9           |
| શુક્રવાર | 9           |
| શનિવાર   | 5           |
| કુલ      | 53          |

સામાન્ય કામના કલાકો- 8 કલાક દર દિવસે

સામાન્ય દર – રૂ. 10 દર કલાકે

ઓવરટાઇમ દર – એક દિવસમાં 9 કલાક સુધી એકવડા દરેઅનેએક દિવસમાં 9 કલાકથી વધારાના કલાક માટે બમણા દરે. અથવા અઠવાડિયાના 48 કલાક સુધી એકવડા દરેઅને48 થી વધારેકલાક માટેબમણા દરે, બેમાંથી જેકામદારનેવધારેલાભદાયક હોય તે.

પ્રશ્ન-3 (અ)પરોક્ષ ખર્ચની અધિક વસૂલાત અને કમ વસૂલાત પર ટૂંકનોંધ લખો.

(બ) એક કંપનીમાં ત્રણ ઉત્પાદન વિભાગો અને બે સેવા વિભાગો છે. માર્ચ માસ દરમિયાન ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે.

|               | Rs.    |
|---------------|--------|
| ભાડુ અને વેરા | ૧૦,૦૦૦ |
| વીજળી બત્તી   | ૧,૨૦૦  |
| પરોક્ષ મજૂરી  | ૩,૦૦૦  |
| પાવર          | ૩,૦૦૦  |

યંત્ર નો ઘસારો

૨૦,૦૦૦

પરચૂરણ ખર્ચા

૨૦,૦૦૦

(1) અન્ય માહિતી:

| વિગત                 | H      | N      | G      | A     | B     |
|----------------------|--------|--------|--------|-------|-------|
| રોકેલી જગ્યા (ચો.મી) | ૨,૦૦૦  | ૨,૫૦૦  | ૩,૦૦૦  | ૨,૦૦૦ | ૫૦૦   |
| વીજળી પોઇન્ટ્સ       | ૨૦     | ૩૦     | ૪૦     | ૨૦    | ૧૦    |
| પ્રત્યક્ષ મજૂરી      | ૬,૦૦૦  | ૪,૦૦૦  | ૬,૦૦૦  | ૩,૦૦૦ | ૧૦૦૦  |
| યંત્રના હોર્સ પાવર   | ૧૨૦    | ૬૦     | ૧૦૦    | ૨૦    | -     |
| યંત્રની કિંમત(Rs)    | ૨૪,૦૦૦ | ૩૨,૦૦૦ | ૪૦,૦૦૦ | ૨,૦૦૦ | ૨,૦૦૦ |
| કામકાજના કલાકો       | ૪,૬૭૦  | ૩,૦૨૦  | ૩,૦૫૦  | -     | -     |

(2) સેવા વિભાગો A અને B નો લાભ અન્ય વિભાગોએ નીચે પ્રમાણે લીધો છે :

| વિગત          | H   | N   | G   | A   | B   |
|---------------|-----|-----|-----|-----|-----|
| સેવા વિભાગ. A | ૨૦% | ૩૦% | ૪૦% | -   | ૧૦% |
| સેવા વિભાગ. B | ૪૦% | ૨૦% | ૩૦% | ૧૦% | -   |

શિરોપરી ખર્ચની જુદા જુદા વિભાગો વચ્ચે ફાળવણી અને સેવા વિભાગોના ખર્ચની ઉત્પાદન વિભાગો વચ્ચે ફાળવણી દર્શાવતુ પત્રક તૈયાર કરો:

અથવા

પ્રશ્ન-૩ ભારત કંપનીમાં કુલ ચાર વિભાગો છે: અ , બ અનેક ઉત્પાદન વિભાગ તથા ૬ સેવા વિભાગ છે. એક મહિનાના ખર્ચની વિગત નીચેપ્રમાણે આપવામાં આવી છે:

|                         |      |
|-------------------------|------|
| પરોક્ષ ખર્ચ             | 1000 |
| ભાડું                   | 2200 |
| યંત્ર મરામત             | 1200 |
| ઘસારો                   | 900  |
| વીજળી                   | 220  |
| સુપરવીઝન ખર્ચ           | 3000 |
| યંત્ર નું વીમા પ્રીમિયમ | 1000 |
| પાવર                    | 1800 |

અન્ય માહિતી :

| વિગત                | અ     | બ     | ક     | ડ    |
|---------------------|-------|-------|-------|------|
| રોકેલ જગ્યા(ચો.ફૂટ) | 250   | 150   | 100   | 50   |
| મજૂરોની સિંખ્યા     | 24    | 16    | 12    | 8    |
| યંત્ર ની કિંમત      | 24000 | 18000 | 12000 | 6000 |
| પ્રત્યક્ષ મજૂરી     | 8000  | 6000  | 4000  | 2000 |
| ખરેખર પાવરની વપરાશ  | 800   | 400   | 400   | 200  |

ઉપરના ખર્ચાઓ જુદા જુદા વિભાગો વચ્ચેયોગ્ય ધોરણેફાળવો.

પ્રશ્ન-4 (અ) ટેન્ડર એટલે શુ અને ટેન્ડર કિંમત કેવી રીતે નક્કી કરવામા આવે છે?

(બ) એલ એન્ડ ટી કંપની લિમીટેડનો પડતર વિભાગ નીચેની માહિતી આપે છે. પડતરનુ પત્રક તૈયાર કરો:

|                                                 |        |
|-------------------------------------------------|--------|
| માલસામાન ખર્ચ                                   | ૨૪,૦૦૦ |
| સીધી મજૂરી                                      | ૧૬,૦૦૦ |
| કારખાના પરીક્ષ ખર્ચા મજૂરીના ૫૦% છે.            |        |
| નહી વેચાયેલ માલસામાન કારખાના પડતરના ૧૦% છે.     |        |
| વેચાણ વિતરણ ના પરીક્ષ ખર્ચા મજૂરી ખર્ચ જેટલા છે |        |
| વેચાણ કિંમત                                     | ૮૦,૦૦૦ |
| નફો વેચાણ કિંમતના ૧૦% છે.                       |        |
| ઓફિસના પરીક્ષ ખર્ચા વેચાણ કિંમતના ૧૬% છે.       |        |

અથવા

પ્રશ્ન-4 તુષાર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની 2025 ના વર્ષમાં પોતાની 50% ઉત્પાદનક્ષમતાએ 5000 ઘડિયાળ બનાવીનેવેચી. ઘડિયાળની એકમદીઠ પડતરનીચેમુજબ હતી :

| વિગત          | Rs. |
|---------------|-----|
| સીધો માલસામાન | 100 |
| સીધી મજૂરી    | 50  |
| પ્રાથમિક પડતર | 150 |
| કારખાના ખર્ચા |     |
| - સ્થિર       | 10  |
| - ચલિત        | 20  |
| કારખાના પડતર  | 180 |
| ઓફિસ ખર્ચા    | 20  |
| ઉત્પાદન પડતર  | 200 |
| વેચાણ ખર્ચા   |     |
| સ્થિર         | 40  |
| ચલિત          | 10  |
| કુલ પડતર      | 250 |
| નફો           | 50  |
| વેચાણ કિંમત   | 300 |

202

6 ના વર્ષ માટે અંદાજવામાં આવેલ છેકે

1. પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન કરવામા આવશે અને 80% એકમોનું વેચાણ થશે.
2. માલસામાન તથા મજૂરીના ખર્ચમાં 20% નો વધારો થશે.
3. પડતર પર નફાનો દર ગયા વર્ષ જેટલો જ રહેશે.

ઉપરોક્ત માહિતીના આધારે 2026 ના વર્ષ માટે અંદાજિત નફો અનેકુલ પડતર દર્શાવતું પત્રક તૈયાર કરો.

**પ્રશ્ન-5** (1) નીચેના પૈકી કઈ પડતરની પદ્ધતિ નથી?

(અ) સીમાંત પડતર પદ્ધતિ (બ) જોબ પડતર પદ્ધતિ (ક) બેચ પડતર પદ્ધતિ (ડ) કરાર પડતર પદ્ધતિ

(2) નીચેના પૈકી કયો ખર્ચ પેદાશ પડતર ગણાય?

(અ) પરોક્ષ માલસામાન (બ) વહીવટી સ્ટાફ પગાર (ક) સેલ્સમેનનું કમીશન (ડ) બેંક લોનનું વ્યાજ

(3) નીચે પૈકી કઈ વેતન પ્રથા વ્યક્તિગત પ્રોત્સાહક વેતન પ્રથા નથી?

(અ) બિડો યોજના (બ) ટેલરની ભિન્ન વેતન દર યોજના (ક) મેરીક ની વિવિધ વેતનદર (ડ)

સહભાગીદારી

(4) પ્લાન્ટ રિપેરીંગ શિરોપરી ખર્ચ માટે ફાળવણી નો આધાર?

(અ) રોકેલી જગ્યા (બ) પ્લાન્ટ ની કિંમત (ક) પ્લાન્ટ કલાકો (ડ) પ્લાન્ટ ઘસારો

(5) વેચાણ પડતર ૧,૮૦,૦૦૦ છે. નફાની રકમ ૨૦,૦૦૦ છે. તો નફો વેચાણ પર કેટલા ટકા ગણાય?

(અ) ૧૧% (બ) ૧૦% (ક) ૧૨% (ડ) ૯%

(6) ગેસ પૂરો પાડતી કંપની પડતરની કઈ પદ્ધતિ નો ઉપયોગ કરે છે?

(અ) સેવા પડતરપદ્ધતિ (બ) પ્રક્રિયા પડતર પદ્ધતિ (ક) બેચ પડતર પદ્ધતિ (ડ) જોબ પડતરપદ્ધતિ

(7) જો શરૂઆતનો સ્ટોક 12000, ખરીદી 24000 અને આખર સ્ટોક 4000 હોય તો માલસામાનની ફેરબદલી દર કેટલો થાય?

(અ) 4 વખત (બ) 5 વખત (ક) 7 વખત (ડ) 3.5 વખત

(8) જો સંચાલન કાર્યદક્ષ હશે તો મજૂર ફેરબદલી દર-

(અ) વધી શકે (બ) શૂન્ય કરી શકાય (ક) કોઈ અસર પડતી નથી (ડ) ઘટાડી શકાય

(9) પરોક્ષ મજૂરી માટે ફાળવણીનો આધાર કયો છે?

(અ) પ્રત્યક્ષમજૂરીપ્રમાણ (બ) મજૂર સંખ્યાનું પ્રમાણ (ક) મજૂર કલાકોનું પ્રમાણ (ડ) ચંત્ર કલાક દર

(10) વેચેલ માલની પડતર રૂ. 270000, નફાની રકમ રૂ. 30000 હોય તો વેચાણ પર નફાનો દરશોધો?

(અ) 10% (બ) 11% (ક) 15% (ડ) 9%

Ahmedabad Arts and Commerce College  
Assignment  
BCOM Semester 3  
Subject Code: DSC-C-232  
Subject Name: Corporate Accounting  
English Medium

**Q-1(A)** Janak Ltd. was incorporated on 1-4-2020 to purchase a running business of a firm from 1-1-2020, From the information given below for the year ending on 31-12-2020, determine profit prior to incorporation and post incorporation.

The total sales of the year ending on 31-12-2020 was Rs.15,00,000, out of which sales from 1-1-2020 to 1-4-2020 amounted to Rs. 3,00,000. Gross Profit is 40% of sales.

**Other Information's :**

| Particulars            | Rs.      |
|------------------------|----------|
| Rent                   | 80,000   |
| Salaries of Employees  | 1,20,000 |
| Interest on Debentures | 45,000   |
| General expenses       | 32,000   |
| Audit fees             | 20,000   |
| Directors' fees        | 25,000   |
| Formation expenses     | 22,000   |
| Sales Commission       | 45,000   |

**(B)** Balance sheet of Sant Brothers as on 31-3-2024 is as under

| Liabilities                    | Rs.              | Assets                     | Rs.              |
|--------------------------------|------------------|----------------------------|------------------|
| Capital:                       |                  | Goodwill                   | 1,82,000         |
| Prince      3,15,000           |                  | Trademark                  | 1,96,000         |
| Parth <u>2,45,000</u>          | 5,60,000         | Land & Building            | 6,16,000         |
| General reserve                | 35,000           | Plant & Machinery          | 2,80,000         |
| Profit & Loss A/c              | 1,05,000         | Furniture                  | 1,13,000         |
| Bank Loan                      | 2,10,000         | Stock                      | 14,000           |
| Creditors                      | 3,50,000         | Debtors                    | 11,200           |
| Bills Payable                  | 1,12,000         | Bills Receivable           | 2,800            |
| Outstanding Expenses           | 28,000           | Bank Balance               | 14,000           |
| Depreciation Fund for Building | 56,000           | Advertisement Suspense A/c | 26,600           |
|                                | <u>14,56,000</u> |                            | <u>14,56,000</u> |

**OR**

**Q-1(A)** Vivek Company Ltd. was incorporated on 1-7-2020 to purchase a business of partnership firm from 1-4-2020. From the following information, prepare statement showing profit or losses prior to incorporation and after incorporation of the company for the year ending on 31-3-2021:

| <b>Particulars</b>     | <b>Rs.</b> |
|------------------------|------------|
| Rent & Taxes           | 40,000     |
| Employee's Salary      | 68,000     |
| Interest on Debentures | 20,000     |
| General Expenses       | 12,000     |
| Audit fees             | 1,600      |
| Director's fees        | 7,000      |
| Sales Commission       | 16,000     |
| Preliminary Expenses   | 4,000      |
| Bad Debts              | 700        |
| Share Transfer Fees    | 1,200      |
| Advertisement Expenses | 3,200      |

**Additional Information:**

- (1) The total sales for the year ended on 31-3-2021 was Rs. 10,00,000, of which sales of Rs.2,00,000 was for the period from 1-4-2020 to 30-6-2020.
- (2) The Gross profit for the year ended on 31-3-2021 was Rs. 4,00,000.

**(B)** Viraj Company Ltd. was incorporate to purchase the business of Krupa Brothers. The authorised capital of the company is 25,000 equity shares of Rs. 10 each. The balance sheet of the firm was as under:

| <b>Liabilities</b>     | <b>Rs.</b>      | <b>Assets</b>     | <b>Rs.</b>      |
|------------------------|-----------------|-------------------|-----------------|
| Capital Accounts       |                 | Land & Building   | 3,00,000        |
| Ram           2,00,000 |                 | Plant & Machinery | 2,00,000        |
| Laxman <u>2,00,000</u> | 4,00,000        | Stock             | 1,00,000        |
| Reserves               | 1,00,000        | Debtors           | 70,000          |
| Bank Loan              | 2,00,000        | Investments       | 50,000          |
| Creditors              | 50,000          | Bank balance      | 30,000          |
|                        |                 |                   |                 |
|                        | <u>7,50,000</u> |                   | <u>7,50,000</u> |

Condition for the business purchase were as under:

- (1) Land & Building at Rs. 1,50,000, Plant & Machinery at Rs. 2,25,000 and other assets except investment were taken over at book value and all the liabilities were accepted by the company.
- (2) Godwill of the firm is to be valued at Rs.35,000.

- (3) Preliminary expenses of Rs. 5,000 were paid by the company.
- (4) Purchase consideration was to be paid in 20,000 fully paid equity shares at 20% premium. 10% Debentures of Rs. 1,00,000 and the rest of the amount in cash.
- (5) The remaining shares were issued to the public at 20% premium, which were all taken up and paid for.

Draft journal entries in the books of Viraj Company Ltd. and draw the balance sheet of the company.

**Q-2** The Balance Sheet of Vinod Co. Ltd. as on 31-3-2019 is as under:

| Particulars                                 | Notes | Rs.        |
|---------------------------------------------|-------|------------|
| <b>1.EQUITY AND LIABILITIES:</b>            |       |            |
| <b>(1) Shareholders Fund:</b>               |       |            |
| (a) Share Capital:                          |       |            |
| Equity Shares of Rs.10 each fully paid      |       | 18,00,000  |
| 9% Pref. Shares of Rs.100 each fully paid   |       | 12,00,000  |
| (b) Reserve and Surplus:                    |       |            |
| Workers Accident Compensation Fund          |       | 4,00,000   |
| Profit & Loss A/c (Dr.)                     |       | (8,26,000) |
| <b>(2) Non-Current Liabilities:</b>         |       |            |
| (a) Long Term Borrowings: 8% Debentures     |       | 8,00,000   |
| <b>(3) Current Liabilities:</b>             |       |            |
| (a) Trade Payables: Creditors               |       | 3,36,000   |
| (b) Other Current Liabilities:              |       |            |
| Unpaid interest on debentures               |       | 64,000     |
| Total                                       |       | 37,74,000  |
| <b>2. ASSETS:</b>                           |       |            |
| <b>(1) Non-Current Assets:</b>              |       |            |
| (a) Fixed Assets:                           |       |            |
| (1) Tangible Assets:                        |       |            |
| Land & Building                             |       | 9,60,000   |
| Plant & Machinery                           |       | 9,74,000   |
| (2) Intangible Assets:                      |       |            |
| Goodwill                                    |       | 6,00,000   |
| Patents                                     |       | 3,20,000   |
| (b) Other Non-Current Assets:               |       |            |
| Preliminary Expenses                        |       | 1,20,000   |
| <b>(2) Current Assets:</b>                  |       |            |
| (a) Inventories: Stock                      |       |            |
| (b) Trade Receivable: Debtors               |       | 4,00,000   |
| (c) Cash and Cash Equivalents: Bank balance |       | 3,20,000   |
| Total                                       |       | 80,000     |
|                                             |       | 37,74,000  |

The scheme of capital reduction approved as under:

- (1) Preference Shares and Equity Shares are to be reduced by Rs.20 and Rs. 8 per share respectively.

- (2) Preference dividend is unpaid for two years, the preference shareholders agreed to waive 3/5 of the dividend and remaining paid for cash.
- (3) The debenture holders forgo their unpaid interest and for part payment of debentures they look over machineries of Rs.4,00,000 for the 3,20,000.
- (4) All the intangible and fictitious Assets are to be written off, and debtors and creditors are to be written off by Rs. 40,000 and Rs. 80,000 respectively.
- (5) Land and Buildings are to be shown at market value. The book value of Land and Building is 75% of the market value.

From the above information you are required to pass necessary journal entries and prepare balance sheet thereafter.

**OR**

**Q-2** The Balance Sheet of Janvi Ltd. as on 31-3-2019 is as follows:

| Particulars                                    | Notes | Rs.        |
|------------------------------------------------|-------|------------|
| <b>1.EQUITY AND LIABILITIES:</b>               |       |            |
| <b>(1) Shareholders Fund:</b>                  |       |            |
| (a) Share Capital:                             |       |            |
| Equity Shares of Rs.10 each                    |       | 7,00,000   |
| 10% Pref. Share of Rs.100 each                 |       | 2,00,000   |
| (b) Reserve and Surplus:                       |       |            |
| Profit & Loss A/c (Dr.)                        |       | (2,10,000) |
| <b>(2) Non-Current Liabilities:</b>            |       |            |
| (a) Long Term Borrowings: 15% Debentures       |       | 2,00,000   |
| <b>(3) Current Liabilities:</b>                |       |            |
| (a) Trade Payables: Creditors                  |       | 75,000     |
| Bill Payable                                   |       | 12,500     |
| (b) Other Current Liabilities:                 |       |            |
| Outstanding interest on debentures             |       | 22,500     |
| (c) Shorts Term Provisions: Taxation Provision |       | 50,000     |
| Total                                          |       | 10,50,000  |
| <b>2. ASSETS:</b>                              |       |            |
| <b>(1) Non-Current Assets:</b>                 |       |            |
| (a) Fixed Assets:                              |       |            |
| (1) Tangible Assets:                           |       |            |
| Land & Building                                |       | 4,00,000   |
| Machinery                                      |       | 1,30,000   |
| (2) Intangible Assets:                         |       |            |
| Goodwill                                       |       | 70,000     |
| (b)Non-Current Investments                     |       | 40,000     |
| (c) Other Non-Current Assets:                  |       |            |
| Preliminary Expenses                           |       | 35,000     |
| <b>(2) Current Assets:</b>                     |       |            |
| (a) Inventories: Stock                         |       | 1,95,000   |
| (b) Trade Receivable: Debtors                  |       | 60,000     |
| (c) Cash and Cash Equivalents: Bank balance    |       | 1,20,000   |
| Total                                          |       | 10,50,000  |

**Contingent Liability:** claim against the company Rs.60,000.

The following scheme of capital redemption was approved:

- (1) Preference shares to be reduced up to Rs. 80 per share.
- (2) Equity shares to be reduced by Rs. 6 per share.
- (3) The Debenture holders agreed to forgo 50% of their Outstanding interest and remaining interest amount was paid.
- (4) Debenture holders agreed to accept a piece of land worth Rs. 1,50,000 at Rs.2,00,000 as full payment.
- (5) The remaining land and building were valued at Rs. 2,51,750.
- (6) Rs. 47,000 were realised for investments.
- (7) Reconstruction expenses amounted to Rs. 25,000.
- (9) It was decided that company had to pay the pending claim.
- (10) Intangible and fictitious assets are to be written off.

The remaining amount is to be utilised in writing down Machinery and Stock in proportion of their book values.

Write journal entries in the books of the company.

**Q-3 (A)** The Axis Bank Limited has shown the balance of Rs. 9,90,000 in Its Loan, Cash credit and Overdraft Account as on 1-4-2015 and the balance in Bad Debts Reserve Account as on that date showed Rs.81,000.

During the year 2015-16 the income of interest and discount was Rs. 9,36,000, while sanctioned and recovered loan, cash credit and overdraft was Rs. 11,36,000 and Rs. 10,80,000 respectively.

During the year Rs. 45,000 was written off as bad debts and it was estimated to keep bad debts reserve at Rs. 1,08,000.

Prepare following accounts in the books of the Axis Bank Limited:

- (1) Loan, Cash Credit and Overdraft Account.
- (2) Bad Debts Account.
- (3) Bad Debts Reserve Account.
- (4) Interest and Discount Account.

**(B)** Following details are available from the books of Pavar Bank Limited as on 31-3-2016:

|                                       |              |
|---------------------------------------|--------------|
| Bills Discounted and purchased        | Rs.18,00,000 |
| Discount earned                       | Rs. 2,70,000 |
| Rebate on Bills discounted (1-4-2015) | Rs. 36,000   |

The average due date of the above discounted bills is 15-5-2016.

Rate of discount is 12% p.a.

Pass the Journal Entries and prepare Discount Account.

**OR**

**Q-3** From the following balances of ADC Bank Ltd. as on 31-3-19, prepare profit & Loss A/c (From B) and Schedule 13 to 16:

| <b>Particulars</b>                           | <b>Rs.</b> |
|----------------------------------------------|------------|
| Share Capital                                | 30,00,000  |
| Salary and allowances                        | 10,000     |
| Interest on Loan                             | 4,00,000   |
| Commission and Exchange                      | 15,000     |
| Rent and Taxes                               | 7,000      |
| Audit Fees                                   | 10,000     |
| Interest on Overdraft                        | 1,80,000   |
| Interest on Cash Credit                      | 1,50,000   |
| Interest on Saving Accounts                  | 70,000     |
| Rebate on Bills discounted (1-4-18)          | 5,000      |
| Credit balance of Profit & Loss A/c (1-4-18) | 1,50,000   |
| Miscellaneous incomes                        | 12,000     |
| Rent of safe deposit vault                   | 26,200     |
| Printing & Stationary                        | 8,400      |
| Law charges                                  | 15,000     |
| Director's fees                              | 28,700     |
| Profit on sales of investments               | 24,800     |
| Depreciation on Assets                       | 10,800     |
| Discount received on Bills                   | 22,500     |
| Insurance Premium                            | 17,600     |
| Administrative expenses                      | 18,500     |
| Interest on Fixed Deposits                   | 21,500     |

**Additional Information:**

- (1) Balance of rebate on bills discounted as on 31-3-19 is Rs.7,000.
- (2) Transfer Rs. 8,000 to Bad debts reserve and make provision for taxation of Rs.40,000.

(3) Proposed dividend is 10%.

Keep Statutory Reserve as per law.

**Q-4** The Balance Sheet of Raj Ltd. as on 31-3-2020 is as under the date on which the company liquidated voluntarily:

| Particulars                                 | Notes | Rs.       |
|---------------------------------------------|-------|-----------|
| <b>1.EQUITY AND LIABILITIES:</b>            |       |           |
| <b>(1) Shareholders Fund:</b>               |       |           |
| (a) Share Capital:                          |       |           |
| 15,000 Equity Shares of Rs.100 each,        |       |           |
| Rs.60 paid per share                        |       | 9,00,000  |
| 5,000 Equity Share of Rs.100 each,          |       |           |
| Rs.75 paid per share                        |       | 3,75,000  |
| 10,000 6% Pref. Shares of Rs. 100 each,     |       |           |
| Fully paid                                  |       | 10,00,000 |
| <b>(2) Non-Current Liabilities:</b>         |       |           |
| (a) Long Term Borrowings:                   |       |           |
| 5% Mortgage Debentures                      |       | 5,00,000  |
| Mortgage Loan (against Land & Buildings)    |       | 2,50,000  |
| <b>(3) Current Liabilities:</b>             |       |           |
| (a) Trade Payables: Creditors               |       | 4,00,000  |
| (b) Other Current Liabilities:              |       |           |
| Outstanding interest on debentures          |       | 25,000    |
| Preferential Creditors                      |       | 75,000    |
| Total                                       |       | 35,25,000 |
| <b>2. ASSETS:</b>                           |       |           |
| <b>(1) Non-Current Assets:</b>              |       |           |
| (a) Fixed Assets:                           |       |           |
| (1) Tangible Assets:                        |       |           |
| Land & Building                             |       | 5,00,000  |
| Plant & Machinery                           |       | 12,50,000 |
| (2) Intangible Assets:                      |       |           |
| Patents                                     |       | 2,00,000  |
| (b) Other Non-Current Assets:               |       |           |
| Profit & Loss Account                       |       | 6,00,000  |
| <b>(2) Current Assets:</b>                  |       |           |
| (a) Inventories: Stock                      |       | 2,75,000  |
| (b) Trade Receivable: Debtors               |       | 5,50,000  |
| (c) Cash and Cash Equivalents: Cash balance |       | 1,50,000  |
| Total                                       |       | 35,25,000 |

**Additional Information:**

(1) The Preference dividends were in arrears for two years.

(2) The expense of liquidation amounted to Rs. 54,500.

(3) The assets were realised as follows:

| Particulars                                               | Notes | Rs.              |
|-----------------------------------------------------------|-------|------------------|
| <b>1.EQUITY AND LIABILITIES:</b>                          |       |                  |
| <b>(1) Shareholders Fund:</b>                             |       |                  |
| (a) Share Capital:                                        |       |                  |
| 1,00,000 'A' Equity Shares of Rs.10 each,<br>Rs.8 paid up |       | 8,00,000         |
| 80,000 'B' Equity Share of Rs.10 each,<br>Rs.5 paid up    |       | 4,00,000         |
| 10% Pref. Shares of Rs. 10 each, fully paid up            |       | 4,00,000         |
| <b>(2) Non-Current Liabilities:</b>                       |       |                  |
| (a) Long Term Borrowings:                                 |       |                  |
| 12% Debentures                                            |       | 3,00,000         |
| Mortgage Loan (against Investments)                       |       | 1,00,000         |
| <b>(3) Current Liabilities:</b>                           |       |                  |
| (a) Trade Payables: Sundry Creditors                      |       | 5,40,000         |
| (b) Other Current Liabilities:                            |       |                  |
| Outstanding interest on debentures                        |       | 20,000           |
| Preferential Creditors                                    |       | 60,000           |
| <b>Total</b>                                              |       | <b>26,20,000</b> |
| <b>2. ASSETS:</b>                                         |       |                  |
| <b>(1) Non-Current Assets:</b>                            |       |                  |
| (a) Fixed Assets:                                         |       |                  |
| (1) Tangible Assets                                       |       | 23,00,000        |
| (b) Other Non-Current Assets                              |       | 1,70,000         |
| <b>(2) Current Assets:</b>                                |       |                  |
| (a) Cash and Cash Equivalents: Bank balance               |       | 1,50,000         |
| <b>Total</b>                                              |       | <b>26,20,000</b> |

**Additional Information:**

- (1) The Preference dividends were in arrears for two years.
- (2) Creditors for Loan sold the investments for Rs.2,00,000 and the additional amount was return to the liquidators.
- (3) sundry Assets realised Rs. 14,00,000
- (4) The liquidators is entitled to a remuneration of 5% on the asset realised by him and 3% on surplus received from fully secured creditors.
- (5) Liquidation expenses amounted to Rs. 52,000.
- (6) The Debenture's Final Statement of Receipt and Payments.

**Q-5 MCQ**

- (1) Preliminary expenses are apportioned between two period in---
  - (A) Time Ratio
  - (B) Turnover Ratio
  - (C) Prior to Incorporation Period
  - (D) Post Incorporation Period
- (2) When dissolution expenses of the vendor firm is paid by the purchasing company \_\_\_\_\_ account is debited in the book of purchasing company.
  - (A) Dissolution expenses
  - (B) Goodwill
  - (C) Capital Reserve
  - (D) Vendor Firm
- (3)  $\text{Goodwill} + \text{Net assets} = \text{Purchase Consideration of business}$ , and  $\text{Purchase Consideration of business} + \text{_____} = \text{Net Assets of business}$ .
  - (A) Goodwill
  - (B) Total Assets
  - (C) Capital Reserve
  - (D) Total Liabilities
- (4) When the value of goodwill is not given, the value of goodwill is found out in the purchase of business by applying the following formula.
  - (A)  $\text{Goodwill} = \text{Net Assets} - \text{Purchase price}$
  - (B)  $\text{Goodwill} = \text{Purchase price} - \text{Total Assets}$
  - (C)  $\text{Goodwill} = \text{Total Assets} - \text{Purchase price}$
  - (A)  $\text{Goodwill} = \text{Purchase price} - \text{Net Assets}$
- (5) When Contingent liabilities is paid, we debit—
  - (A) Goodwill A/c
  - (B) Contingent Liabilities A/c

(D) Bank A/c

(D) Capital Reduction A/c

(6) Which service helps customers keep their valuables safely in a bank?

(A) Letter of Credit

(B) Safe Deposit vault

(C) Overdraft

(D) Cash Credit

(7) If under the Scheme of capital reduction, the damaged machinery worth Rs. 1,50,000 is sold out as a scrap for Rs.25,000 then\_\_\_\_

(A) Rs.25,000 should be credited to capital reduction account

(B) Rs.1,50,000 should be debited to capital reduction account

(C) Rs.1,75,000 should be credited to capital reduction account

(D) Rs.1,25,000 should be debited to capital reduction account

(8) Which of the following statement is correct?

(A) The liquidator's statement is a Cash Account only.

(B) The liquidator's statement is a Ledger Account only.

(C) The liquidator's statement is a Rojmel.

(D) None of above

(9) Which of the following is considered as floating charge creditor's

(A) Creditors

(B) Government dues

(C) Provident fund

(D) Debenture

(10) Which is the correct statement for Debenture with floating charge?

(A) it is less secured than unsecured creditors

(B) it is more secured than fully secured creditors

(C) it is less secured than fully secured creditors

(D) None of the above.

**Ahmedabad Arts and Commerce College**  
**Assignment**  
**BCOM Semester 3**  
**Subject Code: DSC-C-232**  
**Subject Name: Corporate Accounting**  
**Gujarati Medium**

---

**Q-1(A)** એક ભાગીદારી પેઢીનો ધંધો તા. 1-1-2020થી ખરીદી લેવા તા. 1-4-2020 ના રોજ જનક લિમિટેડની સ્થાપના કરવામાં આવી. તા.31-12-2020ના રોજ પૂરા થતાં વર્ષની નીચેની માહિતી પરથી સ્થાપના પહેલા અને પછીના નફાની ગણતરી કરો.

તા.31-12-2020ના રોજ પૂરા થતાં વર્ષનું વેચાણ રૂ.15,00,000 છે, જે પૈકી તા.1-1-2020થી તા.1-4-2020 સુધીનું વેચાણ રૂ.3,00,000 હતું. કાચો નફો વેચાણના 40% છે.

અન્ય વિગતો:

|                   | રૂ.      |
|-------------------|----------|
| ભાડું અને વેરા    | 80,000   |
| કર્મચારીનો પગાર   | 1,20,000 |
| ડિબેન્ચર પર વ્યાજ | 45,000   |
| સામાન્ય ખર્ચ      | 32,000   |
| ઓડિટ ફી           | 20,000   |
| ડિરેક્ટર ફી       | 25,000   |
| સ્થાપના ખર્ચ      | 22,000   |
| વેચાણ કમિશન       | 45,000   |

(B) સંત બ્રધર્સનું તા.31-3-2020ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે:

પાકું સરવૈયું

| મૂડી-દેવાં          | રૂ.       | મિલકત-લેણાં        | રૂ.       |
|---------------------|-----------|--------------------|-----------|
| મૂડી ખાતાં:         |           | પાઘડી              | 1,82,000  |
| પ્રિન્સ 3,15,000    |           | ટ્રેડમાર્ક         | 1,96,000  |
| પાર્થ 2,45,000      | 5,60,000  | જમીન-મકાન          | 6,16,000  |
| સામાન્ય અનામત       | 35,000    | પ્લાન્ટ-મશીનરી     | 2,80,000  |
| નફા-નુકસાન ખાતું    | 1,05,000  | ફર્નિચર            | 1,13,400  |
| બેંક લોન            | 2,10,000  | સ્ટોક              | 14,000    |
| લેણદારો             | 3,50,000  | દેવાદારો           | 11,200    |
| દેવી હૂંડી          | 1,12,000  | લેણીહૂંડી          | 2,800     |
| ચુકવવાના બાકી ખર્ચા | 28,000    | બેંક સિલક          | 14,000    |
| મકાનનું ધસારાફંડ    | 56,000    | જાહેરાત ઉપલક ખાતું | 26,600    |
|                     | 14,56,000 |                    | 14,56,000 |

તા.1-4-2024 ના રોજ પ્રિતેશ લિમિટેડ નીચેની શરતોએ ધંધો ખરીદે છે:

(1) કંપની દ્વારા બધી જ મિલકતો અને જવાબદારી લઈ લેવામાં આવી.

(2) કાચમી મિલકતો તેની ચોપડે કિંમત કરતાં 20% વધુ કિંમતે આંકવામાં આવી જ્યારે ચાલુ મિલકતો તેની ચોપડે કિંમતે લેવા સંમતિ થઈ.

પ્રિતેશ લી. ખરીદ કિંમત પેટે દરેક રૂ.10ની કિંમતના 28,000 ઇક્વિટી શેર, 10% પ્રીમિયમે અને દરેક રૂ. 10 ની કિંમતના 25,000 પ્રેફરન્સ શેર આપવા સંમત થયા.

પ્રિતેશ લી.ના ચોપડે ખરીદ કિંમતની ગણતરી દર્શાવી, ઉપરોક્ત વ્યવહારો માટે જરૂરી આમનોંધ લખી, પાકું સરવૈયું તૈયાર કરો.

અથવા

**Q-1(A)** એક ભાગીદારી પેઢીનો ધંધો તા. 1-4-2020થી ખરીદી લેવા તા. 1-7-2020 ના રોજ વિવેક લિમિટેડની સ્થાપના કરવામાં આવી. તા.31-3-2021ના રોજ પૂરા થતાં વર્ષની નીચેની માહિતી પરથી સ્થાપના પહેલા અને પછીના નફાની ગણતરી કરો.

તા.31-3-2021ના રોજ પૂરા થતાં વર્ષનું વેચાણ રૂ.10,00,000 છે, જે પૈકી તા.1-4-2020થી તા.30-6-2020 સુધીનું વેચાણ રૂ.2,00,000 હતું.31-3-2021 ના રોજ પૂરા થતાં વર્ષનો કાચો નફો વેચાણના 4,00,000 છે.

અન્ય વિગતો:

|                   |        |
|-------------------|--------|
|                   | રૂ.    |
| ભાડું અને વેરા    | 40,000 |
| કર્મચારીનો પગાર   | 68,000 |
| ડિબેન્ચર પર વ્યાજ | 20,000 |
| સામાન્ય ખર્ચ      | 12,000 |
| ઓડિટ ફી           | 1,600  |
| ડિરેક્ટર ફી       | 7,000  |
| પ્રાથમિક ખર્ચા    | 4,000  |
| વેચાણ કમિશન       | 16,000 |
| ઘાલખાધ            | 2,000  |
| શેર ફેરબદલી ફી    | 700    |
| ધસારો             | 1,200  |
| જાહેરાત ખર્ચ      | 3,200  |

(B) કૃપા બ્રધર્સનો ધંધો ખરીદવા માટે વિરાજ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી. કંપનીની સત્તાવાર થાપણ દરેક રૂ. 10નો એક એવા 25,000 શેરમાં વહેંચાયેલી છે. પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે:

| મૂડી-દેવાં       | રૂ.             | મિલકત-લેણાં    | રૂ.             |
|------------------|-----------------|----------------|-----------------|
| મૂડી ખાતાં:      |                 | જમીન-મકાન      | 3,00,000        |
| રામ 2,00,000     |                 | પ્લાન્ટ-મશીનરી | 2,00,000        |
| લક્ષ્મણ 2,00,000 | 4,00,000        | સ્ટોક          | 1,00,000        |
| સામાન્ય અનામત    | 1,00,000        | દેવાદારો       | 70,000          |
| બેંક લોન         | 2,00,000        | રોકાણો         | 50,000          |
| લેણદારો          | 50,000          | બેંક સિલક      | 30,000          |
|                  | <u>7,50,000</u> |                | <u>7,50,000</u> |

ધંધાની ખરીદી અંગેની શરતો નિકહ મુજબ નક્કી કરવામાં આવેલ હતી:

(1) જમીન-મકાન રૂ.1,50,000,પ્લાન્ટ-મશીનરી રૂ.2,25,000 તેમજ રોકાણો સિવાયની અન્ય તમામ મિલકતો તેની ચોપડે કિંમતે લેવામાં આવી. આ ઉપરાંત પેઢીની તમામ જવાબદારીઓ પણ ખરીદનાર કંપનીએ સ્વીકારી.

(2) પાઘડીનું મૂલ્ય રૂ.35,000 આંકવામાં આવ્યું.

(3) પ્રાથમિક ખર્ચ રૂ.5,000 કંપની દ્વારા ચૂકવવામાં આવ્યો.

(4) ધંધાની ખરીદ કિંમત પેટેના અવેજ રૂપે પૂરેપૂરા ભરપાઈ થયેલ 20,000 ઇક્વિટી શેર 20% પ્રીમિયમે, બાકીના ડિબેન્ચર રૂ.1,00,000ના અને બાકીની રકમ રોકડમાં ચૂકવી.

(5) કંપનીએ બાકીના શેર 20% પ્રીમિયમે જાહેર જનતા માટે બહાર પાડ્યા, જે બધા શેર પૂર્ણ ભરપાઈ થઈ ગયેલ છે.

વિરાજ કંપની લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોંધ લખી ખરીદી પછીનું પાકું સરવૈયું બનાવ્યું.

Q-2 ધી વિનોદ લિમિટેડનું તા. 31-3-2019ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે.

| વિગત                                                   | નોંધ નંબર | રૂ.        |
|--------------------------------------------------------|-----------|------------|
| 1. ઇક્વિટી અને દેવાં:                                  |           |            |
| (1) શેરહોલ્ડરોનાં ભંડોળો:                              |           |            |
| (અ) શેરમૂડી:                                           |           |            |
| રૂ.10નો એક એવા પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર                 |           | 18,00,000  |
| રૂ.100નો એક એવા 9%ના પ્રેફરન્સશેર પૂરેપૂરા ભરપાઈ થયેલા |           | 12,00,000  |
| (બ) અનામત અને વધારો:                                   |           |            |
| કામદાર અકસ્માત વળતર ભંડોળ                              |           | 4,00,000   |
| નફાનુકસાન ખાતું (ઉધાર)                                 |           | (8,26,000) |
| (2) બિનચાલુ દેવાં:                                     |           |            |
| (અ) લાંબા ગાળાનાં ઉછીના નાણાં:                         |           |            |
| 8%ના ડિબેન્ચર                                          |           | 8,00,000   |

|                                             |  |           |
|---------------------------------------------|--|-----------|
| (3) ચાલુ દેવાં:                             |  |           |
| (અ) વેપારી દેવાં: લેણદારો                   |  | 3,36,000  |
| (બ) અન્ય ચાલુ દેવાં: ડિબેન્ચરનું બાકી વ્યાજ |  | 64,000    |
| કુલ                                         |  | 37,74,000 |
| (1). બિનચાલુ મિલકતો:                        |  |           |
| (અ) કાયમી મિલકતો:                           |  |           |
| (1) દ્રશ્ય મિલકતો:                          |  |           |
| જમીન-મકાન                                   |  | 9,60,000  |
| પ્લાન્ટ-ચંત્ર                               |  | 9,74,000  |
| (2) અદ્રશ્ય મિલકતો:                         |  |           |
| પાઘડી                                       |  | 6,00,000  |
| પેટન્ટસ                                     |  | 3,20,000  |
| (બ) અન્ય બિનચાલુ મિલકતો:                    |  |           |
| પ્રાથમિક ખર્ચ                               |  | 1,20,000  |
| (2 ).ચાલુ મિલકતો:                           |  |           |
| (અ) માલસામગ્રી: સ્ટોક                       |  | 4,00,000  |
| (બ) વેપારી લેણાં: દેવાદારો                  |  | 3,20,000  |
| (ક) રોકડ અને રોકડ સમકક્ષ: બેંક સિલક         |  | 80,000    |
| કુલ                                         |  | 37,74,000 |

મૂડીઘટાડા અંગે નીચે જણાવેલ યોજના મંજૂર થઈ:

(1) પ્રેફરન્સ શેર અને ઈક્વિટી શેર અનુક્રમે શેરદીઠ રૂ.20 અને રૂ.8થી ઘટાડવાના છે.

(2) પ્રેફરન્સ શેર પર 2 વર્ષનું ડિવિડન્ડ બાકી છે. પ્રેફરન્સ શેરહોલ્ડર્સ તેમનું 3/5 ભાગનું ડિવિડન્ડ જતું કરે છે, અને બાકીના ડિવિડન્ડ પેટે રોકડ સ્વીકારે છે.

(3) ડિબેન્ચર હોલ્ડરોએ તેમનું બાકી વ્યાજ જતું કર્યું અને ડિબેન્ચર હોલ્ડર્સની અંશતઃ ચુકવણી પેટે રૂ.4,00,000 ની મૂળ કિંમતનાં ચંત્રો રૂ.3,20,000 ની કિંમતે લઈ લીધાં.

(4) તમામ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે અને દેવાદારો અને લેણદારો અનુક્રમે રૂ.40,000 અને 80,000 માંડી વાળવાના છે.

(5) જમીન-મકાન બજાર કિંમતે દર્શાવવાના છે. ચોપડે દર્શાવેલી કિંમત બજાર કિંમતના 75% છે.

આપેલી માહિતી પરથી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો અને ત્યાર પછીનું પાકું સરવૈયું તૈયાર કરો.

અથવા

Q-2 જાનવી લિમિટેડનું તા. 31-3-2019ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે.

| વિગત                                   | નોંધ નંબર | રૂ.        |
|----------------------------------------|-----------|------------|
| 1. ઈક્વિટી અને દેવાં:                  |           |            |
| (1) શેરહોલ્ડરોનાં ભંડોળો:              |           |            |
| (અ) શેરમૂડી:                           |           |            |
| રૂ.10નો એક એવા પૂર્ણ ભરપાઈ ઈક્વિટી શેર |           | 7,00,000   |
| રૂ.100નો એક એવા 10%ના પ્રેફરન્સશેર     |           | 2,00,000   |
| (બ) અનામત અને વધારો:                   |           |            |
| નફાનુકસાન ખાતું (ઉધાર)                 |           | (2,10,000) |
| (2) બિનચાલુ દેવાં:                     |           |            |
| (અ) લાંબા ગાળાનાં ઉછીના નાણાં:         |           |            |
| 15%ના ડિબેન્ચર                         |           | 2,00,000   |
| (3) ચાલુ દેવાં:                        |           |            |
| (અ) વેપારી દેવાં: લેણદારો              |           | 75,000     |
| દેવીહૂંડી                              |           | 12,500     |
| (બ)અન્ય ચાલુ દેવાં: ડિબેન્ચરનું બાકી   |           | 22,500     |
| વ્યાજ                                  |           |            |
| (ક)ટુંકા ગાળાની જોગવાઈઓ:               |           |            |
| કરવેરાની જોગવાઈ                        |           | 50,000     |
| કુલ                                    |           | 10,50,000  |
| (1). બિનચાલુ મિલકતો:                   |           |            |
| (અ) કાયમી મિલકતો:                      |           |            |
| (1)દ્રશ્ય મિલકતો:                      |           |            |

|                                       |           |
|---------------------------------------|-----------|
| જમીન-મકાન                             | 4,00,000  |
| મશીનરી                                | 1,30,000  |
| (2)અદ્રશ્ય મિલકતો:પાઘડી               | 70,000    |
| (બ) બિનચાલુ રોકાણો                    | 40,000    |
| (બ) અન્ય બિનચાલુ મિલકતો:પ્રાથમિક ખર્ચ | 35,000    |
| (2 ).ચાલુ મિલકતો:                     |           |
| (અ) માલસામગ્રી: સ્ટોક                 | 1,95,000  |
| (બ) વેપારી લેણાં: દેવાદારો            | 60,000    |
| (ક) રોકડ અને રોકડ સમકક્ષ: બેંક સિલક   | 1,20,000  |
| કુલ                                   | 10,50,000 |

આકસ્મિક જવાબદારી: કંપની સામેના દાવાની રકમ રૂ.60,000.

મૂડીઘટાડા અંગે નીચે જણાવેલ યોજના મંજૂર થઈ:

- (1) પ્રેફરન્સ શેરમૂડીની કિંમત રૂ.80 સુધી ઘટાડવામાં આવી.
- (2)ઈક્વિટી શેરમૂડીની કિંમતમાં રૂ.6નો ઘટાડો કરવામાં આવ્યો.
- (3)ડિબેન્ચરહોલ્ડરોએ જમીનનો એક ટુકડો કે જેની કિંમત રૂ.1,50,000 હતી તે જમીન રૂ.2,00,000માં સ્વીકારી.
- (4) ડિબેન્ચરહોલ્ડરોએ તેમની લેણી નીકળતી 50% વ્યાજની રકમ જતી કરી અને બાકી વ્યાજની રકમ ચૂકવવામાં આવી.
- (5) બાકીની જમીનની કિંમત રૂ. 2,51,750 આંકવામાં આવી.
- (6) રોકાણોના રૂ.47,000 ઉપજ્યા.
- (7) પુનઃરચના ખર્ચ રૂ.25,000 થયો.
- (8) કંપનીએ બાકીના દાવાની અંગેની રકમ ચૂકવવાનું સ્વીકાર્યું.

- (9) ચોપડે દર્શાવેલ તમામ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વળવામાં આવી.  
(10) બાકી વધેલ રકમનો ઉપયોગ મશીનરી અને સ્ટોકને તેની ચોપડે દર્શાવેલ કિંમતના પ્રમાણમાં માંડી વળવા માટે કર્યો.

કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો.

**Q-3 (A)** ધી એક્સિસ બેંક લિમિટેડના ચોપડે તા.1-4-2017ના રોજ લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટની કુલ બાકી રૂ.9,90,000 હતી. જ્યારે ધાલખાધ અનામત ખાતું રૂ.81,000 ની બાકી દર્શાવતું હતું.

2017-18ના વર્ષ દરમિયાન વ્યાજ અને વટાવની આવક રૂ.9,36,000 ની થઈ હતી. મંજૂર કરેલ અને વસૂલ કરેલ લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ અનુક્રમે રૂ.11,16,000 અને રૂ.10,80,000 હતો. વર્ષ દરમિયાન રૂ.45,000 ની ધાલખાધ લખી વાળવામાં આવી અને ધાલખાધ અનામત પેટે રૂ.1,08,000 રાખવા આવશ્યક છે.

ધી એક્સિસ બેંક લિમિટેડના ચોપડે-

- (1) લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટનું ખાતું  
(2) ધાલખાધ ખાતું  
(3) ધાલખાધ અનામત ખાતું તથા  
(4) વ્યાજ અને વટાવનું ખાતું તૈયાર કરો.

**(B)** પાવર બેંક લી.ના હિસાબી ચોપડા પરથી તા.31-3-2018 ના રોજ નીચેની વિગતો મળે છે.

|                                      |              |
|--------------------------------------|--------------|
| ખરીદેલી અને વટાવેલી હૂંડીઓ           | રૂ.18,00,000 |
| મળેલ વટાવ                            | રૂ. 2,70,000 |
| વટાવેલી હૂંડીઓ પરનું વળતર (1-4-2017) | રૂ. 36,000   |

વટાવેલી હૂંડીઓની સરેરાશ પાકતી તારીખ 15-5-2018 છે. અને વટાવનો દર વાર્ષિક 12% છે.

જરૂરી આમનોંધ લખો અને વટાવ ખાતું તૈયાર કરો.

#### અથવા

**Q-3** ધી એડીસી બેંક લિમિટેડની તા. 31-3-2019ના રોજની નીચે આપેલી બાકીઓ પરથી નફા- નુકસાન ખાતું (ફોર્મ-B) અને પરિશિષ્ટ-13 થી 16 તૈયાર કરો.

| વિગત                                   | રૂ.       |
|----------------------------------------|-----------|
| શેરમૂડી                                | 30,00,000 |
| પગાર અને ભથ્થા                         | 10,000    |
| લોન પર વ્યાજ                           | 4,00,000  |
| કમિશન અને દલાલી                        | 15,000    |
| ભાડું અને વેરા                         | 7,000     |
| ઓડિટ ફી                                | 10,000    |
| ઓવરડ્રાફ્ટ નું વ્યાજ                   | 1,80,000  |
| કેશ કેડિટનું વ્યાજ                     | 1,50,000  |
| બચત ખાતાનું વ્યાજ                      | 70,000    |
| ચાલુ ખાતાનું વ્યાજ                     | 70,000    |
| વટાવેલી હૂંડીઓ પરનું વળતર (1-4-2018)   | 5,000     |
| નફાનુકસાન ખાતાની જમાબાકી(તા. 1-4-2018) | 1,50,000  |
| પરચુરણ આવક                             | 12,000    |

|                             |        |
|-----------------------------|--------|
| સેઈફ ડિપોઝિટ વોલ્ટનું ભાડું | 26,200 |
| પ્રિન્ટિંગ અને સ્ટેશનરી     | 8,400  |
| રોકાણોના વેચાણનો નફો        | 24,800 |
| કાનૂની ખર્ચા                | 15,000 |
| ડિરેક્ટર ફી                 | 28,700 |
| મિલકત પર ધસારો              | 10,800 |
| હૂંડી પર મળેલ વટાવ          | 22,500 |
| વીમા પ્રીમિયમ               | 17,600 |
| વહીવટી ખર્ચા                | 18,500 |
| ફિક્સ્ડ ડિપોઝિટનું વ્યાજ    | 21,500 |

વધારાની વિગતો:

- (1) તા.31-3-2019ના રોજ વટાવેલી હૂંડીઓ પર વળતરની બાકી રૂ.7,000 છે.
- (2) ધાલખાધ માટે રૂ.8,000 અને કરવેરા માટે રૂ.40,000 ની જોગવાઈ કરવાની છે.
- (3) સૂચિત ડિવિડન્ડ 10% છે.
- (4) કાયદા મુજબ કાનૂની અનામતની જોગવાઈ કરવાની છે.

**Q-4** રાજ લિમિટેડનું તા. 31-3-2019ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. જે દિવસે તેનું સ્વૈચ્છિક વિસર્જન થયું:

| વિગત                      | નોંધ નંબર | રૂ. |
|---------------------------|-----------|-----|
| 1. ઈક્વિટી અને દેવાં:     |           |     |
| (1) શેરહોલ્ડરોનાં ભંડોળો: |           |     |
| (અ) શેરમૂડી:              |           |     |

|                                                         |  |           |
|---------------------------------------------------------|--|-----------|
| રૂ.100નો એવા 15,000 ઈક્વિટી શેર,<br>શેરદીઠ રૂ.60 ભરપાઈ  |  | 9,00,000  |
| રૂ.100નો એવા 5,000 ઈક્વિટી શેર,<br>શેરદીઠ રૂ.75 ભરપાઈ   |  | 3,75,000  |
| રૂ.100નો એવા 10,000 ઈક્વિટી શેર,<br>6%ના પરફોર્મન્સ શેર |  | 10,00,000 |
| (2) બિનચાલુ દેવાં:                                      |  |           |
| (અ) લાંબા ગાળાનાં ઉછીના નાણાં:                          |  |           |
| 5%ના ગીરો ડિબેન્ચર                                      |  | 5,00,000  |
| ગીરો લોન(જમીન-મકાનના તારણ પર)                           |  | 2,50,000  |
| (3) ચાલુ દેવાં:                                         |  |           |
| (અ) વેપારી દેવાં: લેણદારો                               |  | 4,00,000  |
| (બ)અન્ય ચાલુ દેવાં:                                     |  |           |
| ડિબેન્ચરનું બાકીવ્યાજ                                   |  | 25,000    |
| પસંદગીના લેણદારો                                        |  | 75,000    |
| કુલ                                                     |  | 35,25,000 |
| 2. મિલકતો:                                              |  |           |
| (1). બિનચાલુ મિલકતો:                                    |  |           |
| (અ) કાયમી મિલકતો:                                       |  |           |
| (1)દ્રશ્ય મિલકતો:                                       |  |           |
| જમીન-મકાન                                               |  | 5,00,000  |
| પ્લાન્ટ-ચંત્રો                                          |  | 12,50,000 |
| (2)અદ્રશ્ય મિલકતો:પેટન્ટ્સ                              |  | 2,00,000  |
| (બ) અન્ય બિનચાલુ મિલકતો:                                |  |           |
| નફા નુકસાન ખાતું                                        |  | 6,00,000  |
| (2 ).ચાલુ મિલકતો:                                       |  |           |
| (અ) માલસામગ્રી: સ્ટોક                                   |  | 2,75,000  |
| (બ) વેપારી લેણાં: દેવાદારો                              |  | 5,50,000  |
| (ક) રોકડ અને રોકડ સમકક્ષ: રોકડ                          |  | 1,50,000  |
| કુલ                                                     |  | 35,25,000 |

વધારાની માહિતી :

(1) પ્રેફરન્સ શેર પર છેલ્લા બે વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે.

(2) વિસર્જન ખર્ચ રૂ.54,500 થયો છે.

(3) મિલકતોના નીચે પ્રમાણે ઉપજ્યા:

રૂ.

|                |           |
|----------------|-----------|
| પેટન્ટ્સ       | 1,50,000  |
| સ્ટોક          | 3,00,000  |
| જમીન-મકાન      | 6,00,000  |
| દેવાદારો       | 4,00,000  |
| પ્લાન્ટ-ચંત્રો | 10,00,000 |

(4) લિક્વિડેટરને મિલકત વેચાણની ઉપજના 3% લેખે અને પસંદગીના લેણદારો સિવાયના બિનસલામત લેન્ડયરોને ચૂકવેલ રકમના 2% લેખે મહેનતાણું આપવાનું છે.

લિક્વિડેટરનું છેવટનું આવક-જાવક પત્રક બનાવો.

અથવા

**Q-4** દેવાંગ લિમિટેડનું તા.31-3-2020ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. જે દિવસે તેનું સ્વૈચ્છિક વિસર્જન થયું:

| વિગત                                                                                                                                                                                    | નોંધ નંબર | રૂ.                  |
|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-----------|----------------------|
| 1. ઈક્વિટી અને દેવાં:<br>(1) શેરહોલ્ડરોનાં ભંડોળો:<br>(અ) શેરમૂડી:<br>રૂ.10નો એવા 1,00,000 A ઈક્વિટી શેર,<br>શેરદીઠ રૂ.8 ભરપાઈ<br>રૂ.10નો એવા 8,000 B ઈક્વિટી શેર,<br>શેરદીઠ રૂ.5 ભરપાઈ |           | 8,00,000<br>4,00,000 |

|                                                     |  |           |
|-----------------------------------------------------|--|-----------|
| 10%ના કચુ. પ્રેફરન્સ શેર, રૂ.10નો એવા<br>પૂરા ભરપાઈ |  | 4,00,000  |
| (2) બિનચાલુ દેવાં:                                  |  |           |
| (અ) લાંબા ગાળાનાં ઉછીના નાણાં:                      |  |           |
| 12%ના ડિબેન્ચર                                      |  | 3,00,000  |
| ગીરો લોન(રોકાણ પર)                                  |  | 1,00,000  |
| (3) ચાલુ દેવાં:                                     |  |           |
| (અ) વેપારી દેવાં: લેણદારો                           |  | 6,00,000  |
| (બ)અન્ય ચાલુ દેવાં:                                 |  |           |
| ડિબેન્ચર પર ચઢેલ વ્યાજ                              |  | 20,000    |
| કુલ                                                 |  | 26,20,000 |
| 2. મિલકતો:                                          |  |           |
| (1). બિનચાલુ મિલકતો:                                |  |           |
| (અ) કાયમી મિલકતો:(1)દ્રશ્ય મિલકતો                   |  | 23,00,000 |
| (બ) બિનચાલુ રોકાણો                                  |  | 1,70,000  |
| (2). ચાલુ મિલકતો                                    |  |           |
| (અ) રોકડ અને રોકડ સમકક્ષ: રોકડ                      |  | 1,50,000  |
| કુલ                                                 |  | 26,20,000 |

અન્ય માહિતી:

- (1) પ્રેફરન્સ શેર પર એક વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે.
- (2) પરચુરણ લેણદારોમાં રૂ.60,000ના પસંદગીના લેણદારોનો સમાવેશ થયેલ છે.
- (3) લોનના લેણદારોમાં રોકાણો રૂ.2,00,000માં વેચ્યા અને વધારાની રકમ પર લિક્વિડેટરને પરત કરી.
- (4) પરચુરણ મિલકતોના રૂ.14,00,000 ઉપજ્યા.
- (5) લિક્વિડેટરનું મહેનતાણું તેણે ઉપજાવેલ મિલકતોની રકમ પર 5% અને સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી મળેલ વધારાની રકમ પર 3%લેખે ગણવાનું છે.
- (6) વિસર્જન ખર્ચ રૂ.52,000 થયેલ છે.

(7) ડિબેન્યરહોલ્ડરોને તા.30-6-2020ના રોજ ચૂકવવામાં આવ્યા.

લિક્વિડેટરનું છેવટનું આવક-જાવક પત્રક બનાવો.

#### Q-5 MCQ

(1) પ્રાથમિક ખર્ચ નોંધાશે \_\_\_\_

(અ) સમયના પ્રમાણમાં

(બ) વેચાણનાં પ્રમાણમાં

(ક) નોંધણી પહેલાંના સમયમાં

(ડ) નોંધણી પછીના સમયમાં

(2) જ્યારે વેચનાર પેઢીનો વિસર્જન ખર્ચ ખરીદનાર કંપની ચૂકવે ત્યારે ખરીદનાર કંપનીના ચોપડામાં\_\_\_\_\_ ખાતું ઉધારવામાં આવે છે.

(અ) વિસર્જન ખર્ચ

(બ) પાઘડી

(ક) મૂડી અનામત

(ડ) વેચનાર પેઢી

(3) પાઘડી+ચોખ્ખી મિલકત=ધંધાની ખરીદ કિંમત અને ધંધાની ખરીદ કિંમત+\_\_\_\_\_ ધંધાની ચોખ્ખી મિલકત.

(અ) પાઘડી

(બ) કુલ મિલકતો

(ક) મૂડી અનામત

(ડ) કુલ જવાબદારીઓ

(4) ધંધાની ખરીદીમાં પાઘડીની કિંમત આપવામાં ન આવેલ તો નીચેના સૂત્ર પરથી પાઘડીની કિંમત શોધવામાં આવે છે.

(અ) પાઘડી=ચોખ્ખી મિલકતો બાદ ધંધાની ખરીદ કિંમત

(બ) પાઘડી= ધંધાની ખરીદ કિંમત બાદ કુલ મિલકતો

(ક) પાઘડી= કુલ મિલકતો બાદ ધંધાની ખરીદ કિંમત

(ડ) પાઘડી= ધંધાની ખરીદ કિંમત બાદ ચોખ્ખી મિલકતો

(5) આકસ્મિક જવાબદારી ચૂકવાય ત્યારે આપણે ઉધારીયે \_\_\_\_

(અ) પાઘડી ખાતું (બ) આકસ્મિક જવાબદારીનું ખાતું

(ક) બેંક ખાતું (ડ) મૂડીઘટાડા ખાતું

(6) કઈ સેવા ગ્રાહકોને બેંકમાં તેમની કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે?

(અ) લેટર ઓફ ક્રેડિટ (બ) સેફ ડિપોઝીટ વોલ્ટ

(ક) ઓવરડ્રાફ્ટ (ડ) ક્રેશ ક્રેડિટ

(7) જો મૂડી ઘટાડાની યોજના હેઠળ રૂ.1,50,000 ની કિંમતની ખરાબ થયેલી મશીનરી રૂ.25,000માં ભંગાર તરીકે વેચવામાં આવે તો-

(અ) રૂ.25,000 મૂડીઘટાડા ખાતામાં જમા કરવા જોઈએ

(બ) રૂ.1,50,000 મૂડીઘટાડા ખાતામાં ઉધારવા જોઈએ

(ક) રૂ.1,75,000 મૂડીઘટાડા ખાતામાં જમા કરવા જોઈએ

(ડ) રૂ.1,25,000 મૂડીઘટાડા ખાતામાં ઉધારવા કરવા જોઈએ

(8) નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

(અ) લિક્વિડેટરનું હિસાબી પત્રક એ ફક્ત રોકડ ખાતું છે.

(બ) લિક્વિડેટરનું હિસાબી પત્રક એ ફક્ત ખાતાવહી છે.

(ક) લિક્વિડેટરનું હિસાબી પત્રક એ ફક્ત રોજમેળ છે.

(ડ) ઉપરનામાંથી એકપણ નહીં

(9) નીચેનામાંથી કયા લેણદારો તરતા બોજધારી લેણદારો ગણાય?

(અ) લેણદારો (બ) સરકારી દેવું

(ક) પ્રોવિડંડ ફંડ (ડ) ડિબેન્ચર્સ

(10) તરતા બોજવાળા ડીબેન્યરબમાટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

(અ) તે બિનસલામત લેણદારો કરતાં ઓછા સલામત છે.

(બ) તે સંપૂર્ણ સલામત લેણદારો કરતાં વધુ સલામત છે.

(ક) તે સંપૂર્ણ સલામત લેણદારો કરતાં ઓછા સલામત છે.

(ડ) ઉપરનામાંથી એક પણ નહીં.

# Ahmedabad Arts and Commerce College

## Assignment

### BCOM Semester 3

Subject Code: DSC-C-233

Subject Name: Taxation-1

English Medium

=====

**Q 1(A)** Explain the difference between Direct Taxes & Indirect Taxes with the examples.

**Q 1(B)** Explain the definition of “Previous Year” with its exceptions

**Q 1(C)** Classify the following under the definition of “Person”

1. ATIRA
2. Nirma University
3. KCJM& Associates
4. Gujarat Chamber of Commerce & Industry
5. Shri Hemendra Shah & Family
6. Banas Co-op. Housing Society Ltd.
7. Digitex Technology Ltd.

**Q 1(D)** Write a Short Note on “Central Board of Direct Taxes - CBDT”

**Q 2(A)**

Dr.Akshay Parikh is an Indian Citizen, who provides following information about his stay in India during last eight years. What will be his residential status for AY 2026-2027?

| <b>FY</b> | <b>Days of stay in India</b> | <b>FY</b> | <b>Days of stay in India</b> |
|-----------|------------------------------|-----------|------------------------------|
| 2018-2019 | NIL                          | 2022-2023 | 40                           |
| 2019-2020 | 175                          | 2023-2024 | 200                          |
| 2020-2021 | 190                          | 2024-2025 | 125                          |
| 2021-2022 | NIL                          | 2025-2026 | 85                           |

**Q 2(B)** Give a list of any 10 Exempted Income for an Individual.

**Q 2(C)** Mr. Rajesh Vadgama is resident of Canada. Since last 10 years including PY 2025-2026, he has been visiting India regularly. His incomes for Previous Year 2025-26 were as follows:

| <b>Transactions</b>                                            | <b>₹.</b> |
|----------------------------------------------------------------|-----------|
| 1. Pension received from former employer company in Ahmedabad. | 6,00,000  |
| 2. Interest Income from Fixed Deposits in State Bank of India. | 2,00,000  |
| 3. Rental income from asset in Australia                       | 3,00,000  |
| 4. Business controlled from India; income received in Canada   | 4,00,000  |
| 5. Business income of Australia received in Canada.            | 3,00,000  |

Determine his total gross income for the AY 2026-2027, assuming as if he is (a) Ordinary Resident or (b) Resident but not ordinarily Resident or (c) Non-resident.

**Write a short note.**

- Q 2(D)**
- (1) Tax Deducted at Source (TDS)
  - (2) Permanent Account Number (PAN)
  - (3) Advance Tax

**Q 3.**  
**(A)**

Smt. Swati Dave is working in a Private company in Ahmedabad. Find out his taxable income from Salary for the AY 2026-2027 on the basis of the following information.

1. Basic Salary ₹ 80,000 pm
2. Dearness Allowance 40% of Basic Salary.
3. Transport Allowance ₹ 3,600 p.m.
4. Bonus and Commission ₹ 16,400 (annual)
5. Entertainment Allowance ₹ 2,000 p.m.
6. Children Education Allowance ₹ 600 p.m. (for one child)
7. The employer's contribution @ 14% of basic salary towards his recognized provident fund.
8. Interest credited to recognized provident fund account @ 8.15% is ₹ 14,000
9. The employer has provided a car of 1.8 litres cubic capacity including a Driver. All the expenses are borne by the employer. The car is used for official as well as personal purpose.
10. The employer has made a deduction of ₹ 200 p.m for Professional Tax from his salary.

**Q 3(B)** Shri Parag Rawal is working in a HR department of a company. The following is details of his salary for PY 2024-2025.

1. Basic Salary ₹ 2,50,000
2. Bonus ₹ 16,000
3. Commission on sales @ 0.25% ₹ 50,000
4. Dearness allowance, which is not a part of provident fund benefits, ₹ 30,000.
5. Education allowance for two children ₹ 8,400.
6. The company has provided him a rent-free accommodation owned by the company, whose annual fair rent is ₹ 40,000. The population of the city is 20 lakhs. The company has provided furniture costing ₹ 1,00,000. A token rent of ₹ 500 is deducted by company from salary for this facility.

Determine the taxable value of perquisites of rent-free accommodation provided to him for the AY 2026-2027.

**Q 3(C)** Mr. Amit Sheth retired after 35 years and 8 months service from a private firm. At the time of retirement on 31.12.2025, his monthly salary was ₹ 30,000. Every year he got an increment of ₹ 4,000 on 1<sup>st</sup> July. Dearness allowance was 50% of basic salary and 60% of which was considered for retirement benefit. Actual Gratuity received was ₹ 5,00,000. Calculate taxable amount of Gratuity for PY 2025-2026.

**Q 4(A)** From the following details of house properties of Shri Hitendra Shah, compute taxable income form house property for PY 2025-2026

| PARTICULARS                                                      | HOUSE-A       | HOUSE-B              | HOUSE-C             |
|------------------------------------------------------------------|---------------|----------------------|---------------------|
| Annual Fair Rent                                                 | --            | 1,60,000             | 3,36,000            |
| Annual Rent Receivable                                           | --            | 1,44,000             | 2,88,000            |
| Annual Municipal Value                                           | 3,60,000      | 1,44,000             | 3,60,000            |
| Standard Rent                                                    | 4,00,000      | 1,68,000             | --                  |
| Municipal Tax (Paid)                                             | 16,000        | 8,000                | 16,000              |
| Interest on Loan taken for construction (Current financial year) | 1,40,000      | 40,000               | --                  |
| Capitalized Interest (Construction period)                       | 1,60,000      | 40,000               | --                  |
| Bad-debts                                                        | --            | 16,000               | --                  |
| Vacancy Period                                                   | --            | 1 month              | --                  |
| Outstanding Rent                                                 | --            | --                   | 24,000              |
| Land Revenue                                                     | 6,000         | 12,000               | 14,000              |
| Date of Completion of Construction                               | 31.03.2014    | 31.03.2022           | 30-.06.2025         |
| Use of property                                                  | Self-occupied | Rented for Residence | Rented for Business |

**Q 4(B)** Mr. Nafis Saiyedhas **three houses**, all are self-occupied. The Particulars of the house are as

under:

| Particulars                           | House I  | House II  | House III |
|---------------------------------------|----------|-----------|-----------|
| Municipal Value                       | 1,56,000 | 2,34,000  | 3,20,000  |
| Fair rent Value                       | 1,87,200 | 3,12,000  | 3,60,000  |
| Standard Rent                         | -        | 2,60,000  | 3,60,000  |
| Date of Completion                    | 1.1.1998 | 1.10.1998 | 1.10.2014 |
| Municipal Tax [ paid during the year] | 15,600   | 23,400    | 27,000    |

Suggest which houses should be opted by Mr. Nafis Saiyed to be assessed as self-occupied so that his tax liability is minimum?

**Q 4(C)** Write a note on: Standard Deductions under the head of “Income from House Property”

**Q 5.** Choose the correct answer:

- (1) Which of the following is not a component of Income Tax Law?
  - (a) Income Tax Act, 1961
  - (b) Circulars & Clarifications by CBDT
  - (c) Income Tax Rules, 1962
  - (d) None of the above
- (2) For PY 2025-2026, as per new regime of Income Tax calculation, there is NIL tax up to the income of ₹ \_\_\_\_\_
  - (a) ₹ 2,50,000
  - (b) ₹ 5,00,000
  - (c) ₹ 3,00,000
  - (d) ₹ 7,00,000
- (3) The Indian Government collect Income tax by way of \_\_\_\_\_
  - (a) Self- Assessment Tax
  - (b) T.D.S. (Tax Deducted At Source)
  - (c) Advance Tax
  - (d) Any of the above
- (4) For Indian Citizen or a person of Indian origin, who is being outside India comes to India during the Previous year and his total taxable income except foreign source exceeds ₹15,00,000, he is considered as \_\_\_\_\_if he stays in India for less than 182 days but more than 120days during PY.
  - (a) Non-Resident
  - (b) Deemed to be Resident in India
  - (c) Ordinary Resident
  - (d) Resident but not ordinary Resident
- (5) Mr. Amit Sheth has joined Govt. College as Assistant Professor in the pay scale of ₹ 9,500 – 1,500-15,500 from 1<sup>st</sup> April, 2022. What will be his basic annual salary for PY 2025-2026?
  - (a) ₹ 1,32,000
  - (b) ₹ 1,68,000
  - (c) ₹ 1,50,000
  - (d) ₹ 1,86,000
- (6) Mr. Parthesh Thakkar working with Private Company. He has received ₹ 1,000 per month as Entertainment Allowance. What will be Exempted amount of Entertainment Allowance?
  - (a) ₹ 12,000
  - (b) ₹ 7,000
  - (c) ₹ 5,000
  - (d) ₹ NIL
- (7) In case of a Residential property, Municipal valuation is ₹ 1,40,000, Fair Rent is ₹ 1,50,000, Standard Rent ₹ 1,20,000 and Annual Rent 1,44,000 Property remained vacant for 10 months during the PY 2024-2025 and vacancy loss was ₹ 1,20,000. What is the amount of Gross Annual Value?
  - (a) ₹ 1,40,000
  - (b) ₹ 1,20,000

(c) ₹1,50,000

(d) ₹ 24,000

- (8) Mr. Pavan Buch has taken housing loan as on 1<sup>st</sup> May, 2012. In the year 2019, he has taken additional loan for repairing. What would be the maximum permissible amount of deduction of Interest under the head Income from House Property?

(a) ₹ 1,50,000 & ₹ 30,000

(b) ₹ 2,00,000 & ₹ 30,000

(c) ₹ 1,50,000 & ₹ 2,00,000

(d) ₹ 30,000 & ₹ 30,000

# Ahmedabad Arts and Commerce College

## Assignment

### BCOM Semester 3

Subject Code: DSC-C-233

Subject Name: Taxation-1

Gujarati Medium

પ્રશ્ન-1(અ) પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે સમજાવો.

પ્રશ્ન-1(બ) “પાછલા વર્ષ” ની વ્યાખ્યા તેના અપવાદો સહિત સમજાવો

પ્રશ્ન-1(ક) વ્યક્તિ” ની વ્યાખ્યા હેઠળ નીચેનાનું વર્ગીકરણ કરો. (કોઈપણ પાંચ)

1. અટીરા
2. નીરમાં યુનિવર્સિટી
3. કે.સી.જે.એમ. અને એસોસિએટ્સ
4. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
5. શ્રી હેમેદ્ર શાહ અને પરિવાર
6. બનાસકો-ઓપ. હાઉસિંગ સોસાયટી લિ.
7. ડિજિટલ ટેકનોલોજી લિ.

પ્રશ્ન-1(ડ) ટ્રેકનોંધ લખો: પ્રત્યક્ષ કર વેરાનું મધ્યસ્થ બોર્ડ –CBDT”

પ્રશ્ન 2(અ) ડૉ. અક્ષય પરીખ એક ભારતીય નાગરિક છે, જે છેલ્લા આઠ વર્ષ દરમિયાન ભારતમાં તેમના રોકાણ વિશે નીચેની માહિતી આપે છે. AY 2026-2027 માટે તેમનો રહેઠાણ દરજ્જો શું હશે? નાણાકીય-વર્ષ ભારતમાં રોકાણ ના દિવસો નાણાકીય-વર્ષ ભારતમાં રોકાણ ના દિવસો

|           |     |           |     |
|-----------|-----|-----------|-----|
| 2018-2019 | NIL | 2022-2023 | 40  |
| 2019-2020 | 175 | 2023-2024 | 200 |
| 2020-2021 | 190 | 2024-2025 | 125 |
| 2021-2022 | NIL | 2025-2026 | 85  |

પ્રશ્ન 2(બ) વ્યક્તિ માટે કોઈપણ 10 કરમુક્ત આવકની યાદી આપો.

પ્રશ્ન 2(ક) શ્રી રાજુ વડગામા કેનેડાના રહેવાસી છે. તેઓ પાછલા વર્ષ 2025-2026 સહીત છેલ્લા 10 વર્ષથી ભારતની મુલાકાતે નિયમિત રીતે આવે છે. પાછલા વર્ષ 2025-2026 માં તેમની આવકની ચે મુજબ છે.

આવક ના વ્યવહાર રૂ.

1. અમદાવાદમાં ભૂતપૂર્વ માલિક-કંપની તરફથી પેન્શનની આવક 6,00,000
2. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કાયમી થાપણ (FD) પર વ્યાજની આવક 2,00,000
3. ઓસ્ટ્રેલિયામાં આવેલી મિલકત માંથી મળતી ભાડાની આવક 3,00,000

4. કેનેડામાં મળેલ ધંધાની આવક, જેનું નિયંત્રણ ભારતમાંથી. 4,00,000

5. ઓસ્ટ્રેલિયામાં ધંધાની આવક, જે આવક કેનેડામાં મળી. 3,00,000

ધારો કે જો તે (a) “સામાન્ય રહીશ” હોય અથવા (b) “રહીશ પરંતુ સામાન્ય નહિ” હોય અથવા (c) “બિન-રહીશ” હોય, તો આકારણી વર્ષ 2026-2027 માટે તેની કુલ આવક નક્કી કરો.

ગમે તે એક ઉપર ટૂંક નોંધ લખો

પ્રશ્ન 2(ડ)

(1) મૂળ સ્થાનેથી કર-કપાત (TDS)

(2) કાયમી લેખા સંખ્યા (PAN)

(3) અગાઉથી ચુકવવા-પાત્ર વેરો

પ્રશ્ન 3(અ)

શ્રીમતી સ્વાતી દવે અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. નીચેની માહિતીના આધારે, AY 2026-2027 માટે પગારમાંના શીર્ષક હેઠળ તેમની કરપાત્ર આવક શોધો.

1. મૂળભૂત પગાર ₹ 80,000 (માસિક)

2. મોંઘવારી ભથ્થું મૂળભૂત પગારના 40%.

3. પરિવહન ભથ્થું ₹ 3,600 (માસિક)

4. બોનસ અને કમિશન ₹ 16,400 (વાર્ષિક)

5. મનોરંજન ભથ્થું ₹ 2,000 (માસિક)

6. બાળકોનું શિક્ષણ ભથ્થું ₹ 600 pm (એક બાળક માટે)

7. તેમના માન્ય પ્રોવિડંડ ફંડ માં મૂળ પગારના 14% યોગદાન કંપનીનું છે.

8. માન્ય પ્રોવિડંડ ફંડખાતામાં 8.15% ના દરે ₹ 14,000નું વ્યાજ જમા થયેલ છે

9. કંપનીએ 1.8 લિટર ઘન ક્ષમતાવાળી ડ્રાઈવર સહીત મોટર કારની સગવડ પૂરી પાડી છે. જેના બધા નિભાવ ખર્ચ કંપની દ્વારા ઉઠાવવામાં આવે છે. આ મોટર-કારનો ઉપયોગ કંપની-ઓફીસ તેમજ અંગત હેતુ માટે થાય છે.

10. કંપનીએ તેમના પગારમાંથી વ્યાવસાયવેરા પેટે પ્રતિમાસના ₹ 200 લેખે કપાત કરી છે.

પ્રશ્ન 3(બ)

શ્રી પરાગ રાવલ એક કંપનીના HR વિભાગમાં કામ કરે છે. તેમના પાછલા વર્ષ 2025-2026 ના પગારની વિગતો નીચે મુજબ છે.

1. મૂળ પગાર ₹ 2,50,000

2. બોનસ ₹ 16,000

3. વેચાણ પર કમિશન @ 0.25% લેખે ₹ 50,000

4. મોંઘવારી ભથ્થું, (જે પ્રોવિડંડ-ફંડના લાભનો ભાગ નથી) ₹ 30,000.

5. બે બાળકો માટે શિક્ષણ ભથ્થું ₹ 8,400.

6. કંપનીએ તેમને કંપનીની માલિકીનું ભાડા વગરના રહેઠાણ ના મકાન ની સવલત પૂરી પાડેલ છે. જેનું વાર્ષિક વાજબી ભાડું ₹ 40,000 છે. શહેરની વસ્તી 20 લાખ છે. કંપનીએ ₹ 1,00,000 ફિંમત નું ફર્નિચર પણ આપેલ છે. કંપની આ સવલત માટે ટોકનભાડા પેટે દર મહીને ₹ 500 ની કપાત કરે છે.

આકારણી વર્ષ 2026-2027માટે તેમને આપવામાં આવેલા ભાડા વગરના રહેઠાણ ના મકાન ની સવલત નું કરપાત્ર મૂલ્ય નક્કી કરો.

શ્રી અમિત શેઠ એક ખાનગી કંપનીમાંથી 35 વર્ષ અને 8 મહિનાની નોકરી બાદ નિવૃત્ત થયા.

તા: 31.12.2025ના રોજ નિવૃત્તિ સમયે તેમનો માસિક પગાર રૂ30,000 હતો. દર વર્ષે

પ્રશ્ન 3 (ક)

1લીજુલાઈના રોજ તેમને રૂ4,000 નો વધારો મળતો હતો. મોંઘવારી ભથ્થું મૂળ

પગારના 50% હતું અને જેમાંથી 60% નિવૃત્તિ લાભ માટે ધ્યાનમાં લેવામાં આવતું હતું.

ખરેખર મળેલ ગ્રેયુઇટીની રકમ રૂ 5,00,000 હતી. પાછલા વર્ષ 2025-2026માટે

ગ્રેયુઇટીની કરપાત્ર રકમની ગણતરી કરો

શ્રી હિતેન્દ્રશાહની મકાન મિલકતોની નીચેની વિગતો પરથી , પાછલા વર્ષ 2025-2026માટે

મકાન મિલકત ના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો

પ્રશ્ન 4(અ)

| વિગત                                         | મકાન-અ     | મકાન -બ               | મકાન -ક             |
|----------------------------------------------|------------|-----------------------|---------------------|
| વાર્ષિક વાજબી ભાડું                          | --         | 1,60,000              | 3,36,000            |
| વાર્ષિક મળવા-પાત્ર ભાડું                     | --         | 1,44,000              | 2,88,000            |
| વાર્ષિક મ્યુનિસિપલ આકરણી મૂલ્ય               | 3,60,000   | 1,44,000              | 3,60,000            |
| પ્રમાણભાડું.                                 | 4,00,000   | 1,68,000              | --                  |
| મ્યુનિસિપલ વેરા (ચૂકવાયેલ)                   | 16,000     | 8,000                 | 16,000              |
| બાંધકામ માટે લીધેલ લોન નું વ્યાજ (ચાલુ વર્ષ) | 1,40,000   | 40,000                | --                  |
| મૂડી-કૃત વ્યાજ(બાંધકામ દરમ્યાન ચુકવેલ)       | 1,60,000   | 40,000                | --                  |
| ઘાલ-ખાધ                                      | --         | 16,000                | --                  |
| મકાન ખાલી રહ્યાનો સમય                        | --         | 1 મહિનો               | --                  |
| મળવાનું બાકી ભાડું.                          | --         | --                    | 24,000              |
| જમીન મહેસૂલ                                  | 6,000      | 12,000                | 14,000              |
| બાંધકામ પૂર્ણ થયા તારીખ                      | 31.03.2014 | 31.03.2022            | 30-06.2025          |
| મિલકત નો ઉપયોગ                               | સ્વ-વપરાશ  | રહેઠાણ માટે ભાડે આપેલ | ધંધા માટે ભાડે આપેલ |

પ્રશ્ન 4(બ)

શ્રીનફીસ સૈયદત્રણસ્વ-વપરાશના મકાન ધરાવે છે જેની વિગત નીચે મુજબ છે.

| વિગત                                    | મકાન I   | મકાન II   | મકાન III  |
|-----------------------------------------|----------|-----------|-----------|
| મ્યુનિસિપલ આકરણી મૂલ્ય                  | 1,56,000 | 2,34,000  | 3,20,000  |
| વાજબી ભાડું                             | 1,87,200 | 3,12,000  | 3,60,000  |
| પ્રમાણ ભાડું.                           | -        | 2,60,000  | 3,60,000  |
| બાંધકામ પૂરું થયા તારીખ                 | 1.1.1998 | 1.10.1998 | 1.10.2014 |
| મ્યુનિસિપલ વેરા [વર્ષ દરમ્યાન ચૂકવાયેલ] | 15,600   | 23,400    | 27,000    |

કરવેરા ની જવાબદારી ન્યૂનતમ થાય તેના માટે શ્રી સૈયદે કયા મકાન ને સ્વ-વપરાશ વાળું ગણવું જોઈએ, તે અંગે આપનો અભિપ્રાય આપો.

પ્રશ્ન 4(ક) "મકાન મિલકત ની આવક" ના શીર્ષક હેઠળ મજરે મળતી ખાસ કપાત પર નોંધ લખો.

પ્રશ્ન 5. સાચો જવાબ પસંદ કરો:

- (1) નીચે દર્શાવેલમાંથી કયો આવકવેરા કાયદા નો સ્ત્રોત નથી?
  - (a) આવકવેરા કાયદો, 1961
  - (b) CBDT ના પરિપત્રો તથા ખુલાસા
  - (c) આવકવેરા નિયમન, 1962
  - (d) ઉપરોક્ત પૈકી એક પણ નહિ
- (2) પાછલા વર્ષ 2025-2026, આવકવેરો ગણવાના નવા કરમાળખા મુજબ \_\_\_\_\_ રકમ સુધી ની આવક પર શૂન્ય કર લાગુ પડે છે.
  - (a) ₹ 2,50,000
  - (b) ₹ 5,00,000
  - (c) ₹ 3,00,000
  - (d) ₹ 7,00,000
- (3) ભારતસરકાર \_\_\_\_\_ પદ્ધતિદ્વારા આવકવેરો વસુલ કરે છે.
  - (a) સ્વયંઆકારણીવેરો
  - (b) મૂળ -પ્રાપ્તિસ્થાનોથીકર-કપાત
  - (c) અગાઉથીચુકવવાપાત્રવેરો
  - (d) ઉપરોક્તપૈકીકોઈપણ
- (4) પરદેશમાં રહેતા ભારતીય નાગરિક અથવા મૂળ ભારતીય વંશજ પા દરમિયાન .વ. ની વિદેશના સ્ત્રોત સિવાયની કુલ કરપાત્ર .વ.ભારતની મુલાકાતે આવે અને તેમની પા આવક ₹ 15,00,000 હોય, અને જો પા માં ભારતમાં તેઓએ.વ.182 દિવસથી ઓછો પણ 120 દિવસથી વધુ વસવાટ કર્યો હોય , તો તેમનો રહેઠાણ નો દરજ્જો \_\_\_\_\_ ગણાય
  - (a) “બિન-રહીશ”
  - (b) “ભારતમાં ધારી લીધેલ રહીશ”
  - (c) “સામાન્ય રહીશ”
  - (d) “રહીશ પરંતુ સામાન્ય નહિ”
- (5) શ્રીઅમિત શેઠતા: 1 લી એપ્રિલ 2022 ના રોજ સરકારી કોલેજમાં અધ્યાપક સહાયક તરીકે રૂ. 9,500 - 1,500- 15,500 ના મૂળ પગાર ધોરણે જોડાયા હતા. તેમનો પા.વ. 2025-2026 માં વાર્ષિક પગાર કેટલો થશે?
  - (a) ₹ 1,32,000
  - (b) ₹ 1,68,000
  - (c) ₹ 1,50,000
  - (d) ₹ 1,86,000
- (6) શ્રી પાર્થેશ ઠક્કર એક ખાનગી કંપની માં નોકરી કરે છે. તેમને રૂ. 1,000 માસિક દરે મનોરંજન ભથ્થુ મળેલ છે. તો મનોરંજન ભથ્થાની કેટલી રકમ કરમુક્ત ગણાશે?
  - (a) ₹ 12,000
  - (b) ₹ 7,000
  - (c) ₹ 5,000
  - (d) ₹ NIL
- (7) કોઈએક રહેઠાણના મકાનની મ્યુ.આકારણી મૂલ્ય ₹ 1,40,000, વાજબી ભાડું ₹ 1,50,000, પ્રમાણ ભાડું ₹ 1,20,000 અને વાર્ષિક ભાડું ₹ 1,44,000 છે. મિલકત કુલ 10 મહિના ખાલી

પડી રહેલ જેનું ખાલી રહ્યાનું નુકસાન રૂ. 1,20,000 હતું. આ મકાનનું ગ્રોસવાર્ષિક મૂલ્ય શું ગણાશે?

(a) ₹ 1,40,000

(b) ₹ 1,20,000

(c) ₹1,50,000

(d) ₹ 24,000

(8) શ્રીપાવન બુચએતા:1લીમે, 2012 ના રોજ મકાન અંગે લોન લીધી. વર્ષ 2019 માં તેઓએ મરામત અંગે વધારાની લોન લીધી. તો મકાન-મિલકતના શીર્ષક હેઠળ મકાનની લોનના વ્યાજની કપાતની મહત્તમ રકમ કેટલી?

(a) ₹ 1,50,000 & ₹ 30,000

(b) ₹ 2,00,000 & ₹ 30,000

(c) ₹ 1,50,000 & ₹ 2,00,000

(d) ₹ 30,000 & ₹ 30,000

**Ahmedabad Arts and Commerce College**

**Assignment**

**BCOM Semester 3**

**Subject Code: Economics MDC 234**

**Subject Name: Managerial Economics**

**English Medium**

=====

Q.1 What is managerial economics? Explain its scope.

**OR**

Q.1 Discuss the role of managerial economics as well as various responsibilities.

Q.2 Explain the concept of opportunity cost in managerial economics.

**OR**

Q.2 Explain the concept of risk and uncertainty in managerial economics.

Q.3 What is demand? State the different types of demand.

**OR**

Q.3 Explain the methods of measuring the price elasticity of demand.

Q.4 Explain the concept of fixed cost, variable cost and total cost.

**OR**

Q.4 Explain long-run and short-run cost functions.

Q.5 Choose the correct option from the options given below: (Any Ten)

(1) Which method is commonly used in managerial economics for decision making?

- (A) Motivator Method
- (B) Corporation Method
- (C) Experimental Method
- (D) Comparative Method

(2) Which one from the following is not included in the field of managerial economics?

- (A) Demand Analysis
- (B) Goods Control
- (C) Personal Operating
- (D) Expenses Analysis

(3) What kind of decision is taken by Administrative Economist?

- (A) Government Policy Analysis
  - (B) Marketing Strategy
  - (C) Stock market Predictions
  - (D) The above All
- (4) What is another name of the principle of growth in Managerial economics?
- (A) Marginal Principle
  - (B) Principle of superfluity
  - (C) Crafting of compensation Principle
  - (D) Expenses Benefits Analysis
- (5) In the context of managerial economics, short-run decisions are mainly related to what?
- (A) Incremental cost
  - (B) Total cost
  - (C) Capital investment
  - (D) Long-term profitability
- (6) What is an example of random risk?
- (A) Changes in interest rates
  - (B) Economic recession
  - (C) Management decisions
  - (D) Inflation
- (7) Which of the following is not a type of demand?
- (A) Demand for consumer goods
  - (B) Demand for industrial products
  - (C) Demand for government policies
  - (D) Demand for perishable and durable goods
- (8) How many types of price elasticity of demand are there?
- (A) Two
  - (B) Four
  - (C) Five
  - (D) Seven
- (9) Which of the following goods can have a price-related demand?
- (A) Grain
  - (B) T V
  - (C) Citation
  - (D) Doctor's service
- (10) Which cost is not included in accounting cost but is included in economic cost?
- (A) Wages and salaries
  - (B) Cost of raw materials
  - (C) Imputed costs

(D) Insurance costs

(11) What is another word for direct costs?

(A) Accounting cost

(B) Overhead cost

(C) Variable cost

(D) Sunk cost

(12) Which of the following is an example of indirect cost?

(A) Raw materials

(B) Direct labour

(C) Consumption

(D) Packaging Price

\*\*\*\*\*

**Ahmedabad Arts and Commerce College**

**Assignment**

**BCOM Semester 3**

**Subject Code: Economics MDC 234**

**Subject Name: સંચાલકીય અર્થશાસ્ત્ર**

**Gujarati Medium**

=====

પ્રશ્ન ૧. સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે શું? તેનું કાર્યક્ષેત્ર સમજાવો.

**અથવા**

પ્રશ્ન ૧. સંચાલકીય અર્થશાસ્ત્રની ભૂમિકા તેમજ વિવિધ જવાબદારીઓ ચર્ચો.

પ્રશ્ન ૨. સંચાલકીય અર્થશાસ્ત્રનો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સમજાવો.

**અથવા**

પ્રશ્ન ૨. સંચાલકીય અર્થશાસ્ત્રનો જોખમ અને અનિશ્ચિતતાનો ખ્યાલ સમજાવો.

પ્રશ્ન ૩. માંગ એટલે શું? માંગના વિવિધ પ્રકારો જણાવો.

**અથવા**

પ્રશ્ન ૩. માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની પદ્ધતિઓ સમજાવો.

પ્રશ્ન ૪. સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચનો ખ્યાલ સમજાવો.

**અથવા**

પ્રશ્ન ૪. લાંબાકાળના અને ટૂંકાકાળના ખર્ચ વિધેય સમજાવો.

પ્રશ્ન ૫. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો : (કોઈપણ દસ)

(૧) નિર્ણય લેવા માટે સંચાલકીય અર્થશાસ્ત્રમાં સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

(A) પ્રેરક પદ્ધતિ

(B) નિગમન પદ્ધતિ

(C) પ્રાયોગિક પદ્ધતિ

(D) તુલનાત્મક પદ્ધતિ

(૨) નીચેનામાંથી કયું સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ નથી?

(A) માંગ વિશ્લેષણ

(B) માલસામાન નિયંત્રણ

(C) વ્યક્તિગત સંચાલન

(D) ખર્ચ વિશ્લેષણ

(૩) સંચાલકીય અર્થશાસ્ત્રી શેના સંબંધિત નિર્ણય લેવામાં મદદ કરે છે?

(A) સરકારી નીતિ વિશ્લેષણ

- (B) માર્કેટિંગ વ્યૂહરચના  
(C) શેરબજારની આગાહીઓ  
(D) ઉપરોક્ત તમામ
- (૪) સંચાલકીય અર્થશાસ્ત્રમાં વૃદ્ધિના સિદ્ધાંતનું બીજું નામ શું છે?  
(A) સીમાંત સિદ્ધાંત  
(B) અધિકતાનો સિદ્ધાંત  
(C) ઘટતા વળતરનો સિદ્ધાંત  
(D) ખર્ચ લાભ વિશ્લેષણ
- (૫) સંચાલકીય અર્થશાસ્ત્રના સંદર્ભમાં ટૂંકાગાળાના નિર્ણયો મુખ્યત્વે શેનાથી સંબંધિત છે?  
(A) વધતો ખર્ચ  
(B) કુલ ખર્ચ  
(C) મૂડી રોકાણ  
(D) લાંબા ગાળાની નફાકારકતા
- (૬) અવ્યવસ્થિત જોખમનું ઉદાહરણ કયું છે?  
(A) વ્યાજદરમાં ફેરફાર  
(B) આર્થિક મંદી  
(C) સંચાલકીય નિર્ણયો  
(D) કુગાવો
- (૭) નીચેનામાંથી કયો માંગનો પ્રકાર નથી?  
(A) વપરાશી વસ્તુની માંગ  
(B) ઔદ્યોગિક પેદાશની માંગ  
(C) સરકારી નીતિઓની માંગ  
(D) ટકાઉ અને નાશવંત વસ્તુની માંગ
- (૮) માંગની મૂલ્યસાપેક્ષતાના કેટલા પ્રકાર હોય છે?  
(A) બે  
(B) ચાર  
(C) પાંચ  
(D) સાત
- (૯) નીચેનામાંથી કઈ વસ્તુની માંગ મૂલ્યસાપેક્ષ હોઈ શકે?  
(A) અનાજ  
(B) ટીવી  
(C) ટાંકણી  
(D) ડોક્ટરની સેવા
- (૧૦) કયો ખર્ચ હિસાબી ખર્ચમાં સામેલ નથી પરંતુ આર્થિક ખર્ચમાં સામેલ છે?  
(A) વેતન અને પગાર  
(B) કાયા માલની કિંમત  
(C) આરોપિત ખર્ચ  
(D) વીમા ખર્ચ
- (૧૧) પ્રત્યક્ષ ખર્ચ માટે બીજો શબ્દ શું છે?

- (A) હિસાબી ખર્ચ
- (B) શિરોપરી ખર્ચ
- (C) ચલિત ખર્ચ
- (D) દુબત ખર્ચ

(૧૨) નીચેનામાંથી કયું પરોક્ષ ખર્ચનું ઉદાહરણ છે?

- (A) કાચો માલ
- (B) સીધી મજૂરી
- (C) વપરાશ
- (D) પેકેજિંગની કિંમત

\*\*\*\*\*

# Ahmedabad Arts and Commerce College

## Assignment

### BCOM Semester 3

Subject Code: AEC 235

Subject Name: English & Communication

=====

Q.1 Answer any **Five** questions in brief:

- 1) Who was Subroto Bagchi's role model for success?
- 2) What was Subroto Bagchi's first lesson on success? Who did he learn it from?
- 3) How did Subroto Bagchi's mother inspire him with her vision despite her blindness?
- 4) What examples does Swami Vivekananda provide to illustrate the religious diversity and acceptance in his nation?
- 5) What does Swami Vivekananda consider as the destructive forces that have hindered human Society's advancement?
- 6) What is the significance of the constitution in Dr B R Ambedkar's speech?
- 7) What according to Dr. Ambedkar, are the three things we must do to maintain democracy?

**OR**

Q.1 Write short note on any **ONE** of the following.

- 1) Subroto Bagchi's concept of success.
- 2) Swami Vivekananda's messages on religious tolerance
- 3) Dr. Ambedkar's views on maintaining democracy

Q.2. Briefly discuss any **ONE** of the following:

- 1) Unique features of Indian English
- 2) English as the Language of Global Communication
- 3) Introduction and Definitions of Communication

Q.3. Select the correct option from the given options. (Any Five)

- 1) Why did the author in "Go Kiss the World" not go to school until the age of eight?
  - a) The family moved frequently
  - b) The school was very far away
  - c) There was no primary school nearby
  - d) The author was home schooled
- 2) What was the occasion of Swami Vivekananda's Speech?
  - a) World's parliament of Religions
  - b) Indian Independence Day
  - c) United Nations General Assembly
  - d) International peace conference
- 3) Swami Vivekananda expressed gratitude on behalf of:

- a) Hindu People Only
  - b) Indian monks
  - c) All religions and nations
  - d) Western delegates
- 4) What was the main purpose of Dr B R Ambedkar's speech?
- a) To promote social justice
  - b) To discuss economic democracy
  - c) To explain the significance of reservations
  - d) To advocate for political democracy
- 5) Dr. Ambedkar believed that political democracy without social democracy leads to:
- a) equality
  - b) social justice
  - c) dictatorship
  - d) freedom
- 6) From the following, which is not a Fundamental feature of language?
- a) Productivity
  - b) Simplicity
  - c) Creativity
  - d) Displacement
- 7) Which of the following language exists as the language for global communication?
- a) English
  - b) French
  - c) Gujarati
  - d) Hindi

# Ahmedabad Arts and Commerce College

## Assignment

### BCOM Semester 3

Subject Code: SEC-CES-236

Subject Name: Common Employability Skills

English

=====

Q 1. Briefly discuss any ONE of the following.

- (A) Explain Initiative, Planning, Decision-taking and Problem-solving as personal skills.
- (B) Explain Social Etiquette, Assertiveness, Building Relationships and Conflict Resolution as behavioural skills.
- (C) Explain Self-confidence, Self-motivation, Stress Management, Goal Setting and Time Management.

Q 2. Briefly discuss any ONE of the following.

- (A) Explain the role of a team, selection of team members, team objectives and team rules.
- (B) Explain Know Your Customer (KYC), customer focus, handling grievances and relationship building with customers.
- (C) Explain the professional use of mobile apps, online meeting tools, Artificial Intelligence (AI) and Cyber Security.

Q 3. Choose the correct option. (Any five)

(1) Which skill enables a person to take action without waiting for others?

- (a) Initiative
- (b) Patience
- (c) Empathy
- (d) Listening

(2) Which of the following is a self-management skill?

- (a) Self-confidence
- (b) Greeting customers
- (c) KYC
- (d) Resource management

(3) Which of the following is an emotional intelligence skill?

- (a) Empathy
- (b) Planning
- (c) Writing
- (d) Resource management

(4) Which of the following is an important step in problem-solving?

- (a) Identifying the root cause
- (b) Creating a problem
- (c) Ignoring alternatives
- (d) Avoiding action

(5) Which skill is related to working effectively with other people?

- (a) Teamwork
- (b) Self-grooming

(c) Reading

(d) Digital literacy

(6) Which of the following is an essential digital skill?

(a) Understanding Cyber Security      (b) Social etiquette

(c) Goal setting      (d) Conflict resolution

(7) Which of the following belongs to Green Skills?

(a) Reduce, Reuse, Recycle      (b) Customer focus

(c) Decision-taking      (d) Assertiveness

(8) Which activity is part of customer service skills?

(a) Handling grievances      (b) SWOT analysis

(c) Self-regulation      (d) Critical thinking

# Ahmedabad Arts and Commerce College

## Assignment

### BCOM Semester 3

Subject Code: SEC-CES-236

Subject Name: Common Employability Skills

Gujarati

=====

Q 1. નીચેનામાંથી કોઈપણ એક પર સંક્ષિપ્તમાં ચર્ચા કરો.

- (A) વ્યક્તિગત કૌશલ્યો તરીકે પહેલ, આયોજન, નિર્ણય લેવાની કુશળતા અને સમસ્યા ઉકેલવાની કુશળતા સમજાવો.
- (B) વર્તણૂક કૌશલ્યો તરીકે સામાજિક શિષ્ટાચાર, દૃઢતા, સંબંધોનું નિર્માણ અને સંઘર્ષ નિવારણ સમજાવો.
- (C) સ્વ-વ્યવસ્થાપન કૌશલ્યોમાં આત્મવિશ્વાસ, સ્વ-પ્રેરણા, તણાવ વ્યવસ્થાપન, ધ્યેય નિર્ધારણ અને સમય વ્યવસ્થાપન સમજાવો.

Q 2. નીચેનામાંથી કોઈપણ એક પર સંક્ષિપ્તમાં ચર્ચા કરો.

- (A) ટીમની ભૂમિકા, ટીમસભ્યોની પસંદગી, ટીમના ઉદ્દેશો અને ટીમના નિયમો સમજાવો.
- (B) ગ્રાહક સેવા કૌશલ્યોમાં તમારા ગ્રાહકને જાણો (KYC), ગ્રાહક કેન્દ્રિતતા, ફરિયાદોનું નિવારણ અને ગ્રાહકો સાથે સંબંધ નિર્માણ સમજાવો.
- (C) મોબાઈલ એપ્લિકેશનનો વ્યવસાયિક ઉપયોગ, ઓનલાઈન મીટિંગ સાધનો, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને સાયબર સુરક્ષા સમજાવો.

Q 3. સાચો વિકલ્પ પસંદ કરો. (કોઈ પણ પાંચ)

(1) અન્યની રાહ જોયા વિના કાર્ય કરવાની ક્ષમતા કઈ કુશળતા દર્શાવે છે?

- (a) પહેલ
- (b) ધીરજ
- (c) સહાનુભૂતિ
- (d) શ્રવણ

(2) નીચેનામાંથી કઈ સ્વ-વ્યવસ્થાપન કૌશલ્ય છે?

- (a) આત્મવિશ્વાસ
- (b) ગ્રાહકને અભિવાદન
- (c) KYC
- (d) સંસાધન વ્યવસ્થાપન

(3) નીચેનામાંથી કઈ ભાવનાત્મક બુદ્ધિમત્તાની કૌશલ્ય છે?

- (a) સહાનુભૂતિ
- (b) આયોજન
- (c) લેખન
- (d) સંસાધન વ્યવસ્થાપન

(4) નીચેનામાંથી કયું સમસ્યા ઉકેલવાની પ્રક્રિયાનું મહત્વનું પગલું છે?

- (a) મૂળકારણ ઓળખવું
- (b) સમસ્યા ઊભી કરવી
- (c) વિકલ્પોની અવગણના કરવી
- (d) કાર્યવાહી ટાળવી

(5) અન્ય લોકો સાથે અસરકારક રીતે કામ કરવા સંબંધિત કઈ કૌશલ્ય છે?

(a) ટીમવર્ક

(b) સ્વ-સુશોભન

(c) વાંચન

(d) ડિજિટલ સાક્ષરતા

(6) નીચેનામાંથી કઈ આવશ્યક ડિજિટલ કૌશલ્ય છે?

(a) સાયબરસુરક્ષાની સમજ

(b) સામાજિક શિષ્ટાચાર

(c) ધ્યેય નિર્ધારણ

(d) સંઘર્ષ નિવારણ

(7) નીચેનામાંથી કયું હરિત કૌશલ્યોમાં આવે છે?

(a) ઘટાડો, પુનઃઉપયોગ, પુનઃચક્રણ

(b) ગ્રાહક કેન્દ્રિતતા

(c) નિર્ણય લેવાની કુશળતા

(d) દૃઢતા

(8) નીચેનામાંથી કઈ ગ્રાહક સેવા કૌશલ્યનો ભાગ છે?

(a) ફરિયાદોનું નિવારણ

(b) SWOT વિશ્લેષણ

(c) સ્વ-નિયમન

(d) વિવેચનાત્મક વિચારસરણી

**Ahmedabad Arts and Commerce College**

**Assignment**

**BCOM Semester 3**

**Subject Code: VAC 237**

**Subject Name: INDIC KNOWLEDGE SYSTEM**

**ENGLISH**

=====

Q.1. Explain Shruti and Smriti Parampara in the Indic Knowledge System.

**Or**

Q. 1. A. How are manuscripts preserved as per the Indic Knowledge System?

Q. 1. B. Short Note on importance of Sanskrit language in Indic Knowledge System.

Q. 2. Explain in depth Yog and Pranayam

**Or**

Q. 2. A. Write a short note on Niti Shastra (Law and Order)

Q. 2. B. Write a short note on various types of performing arts.

Q. 3. Multiple choice questions (Any Five)

1. Ayurveda originated from \_\_\_\_\_.
  - a) Greece
  - b) Italy
  - c) China
  - d) India
2. Which ancient Indian scriptures provide guidelines for rulers and administrators?
  - a) Bible
  - b) Bhagwat Geeta
  - c) Quran
  - d) Veda/Upanishad
3. Which musical instrument is associated with Indian classical music?
  - a) Violin
  - b) Guitar
  - c) Piano
  - d) Sitar
4. How many primary rasas are there in Indian aesthetics?
  - a) 5
  - b) 7
  - c) 11
  - d) 9
5. Which language is spoken in Karnataka?
  - a) Tamil
  - b) Telegu
  - c) Gujarati
  - d) Kannada
6. Which principle states that actions have consequences either in this life or in future lives?
  - a) Atman
  - b) Sansar
  - c) Bhakti
  - d) Karma
7. Which ancient text narrates the Kurukshetra war?
  - a) Ramayan
  - b) Garuda Puran
  - c) Rigveda
  - d) Mahabharata

**Ahmedabad Arts and Commerce College**

**Assignment**

**BCOM Semester 3**

**Subject Code: VAC 237**

**Subject Name: INDIC KNOWLEDGE SYSTEM**

**GUJARATI**

=====

પ્રશ્ન ૧. ભારતીય જ્ઞાનપરંપરા મુજબ શ્રુતિ અને સ્મૃતિ પરંપરા સમજાવો

અથવા

પ્રશ્ન ૧. (અ) ભારતીય જ્ઞાનપદ્ધતિમાં હસ્તપ્રતોની જાળવણીની પદ્ધતિ પર ટૂંકનોંધ લખો

પ્રશ્ન ૧. (બ) ભારતીય જ્ઞાનપદ્ધતિમાં સંસ્કૃત ભાષાના મહત્વ પર ટૂંકનોંધ લખો

પ્રશ્ન ૨. યોગ અને પ્રાણાયામ પર સવિસ્તાર ચર્ચા કરો

અથવા

પ્રશ્ન ૨. (અ) પ્રાચીન ભારતના નીતિશાસ્ત્ર ઉપર ટૂંકનોંધ લખો

પ્રશ્ન ૨. (બ) વિવિધ પ્રકારની પર્ફોર્મિંગ આર્ટ્સની કલાઓ પર ટૂંકનોંધ લખો

પ્રશ્ન ૩. બહુવિકલ્પિય પ્રશ્નો (કોઈપણ પાંચ )

૧. આયુર્વેદ ક્યાંની શોધ છે?

અ) ગ્રીસ                                      બ) ઈટલી

ક) ચાઇના                                      ડ) ભારત

૨. કયા પ્રાચીન ભારતીય ગ્રંથો શાસકો અને વહીવટકરતાઓ માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે?

અ) બાઇબલ                                      બ) ભગવત ગીતા

ક) કુરાન                                      ડ) વેદ/ઉપનિષદ

૩. આમાનું કયું વાક્ય ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલ છે?

અ) વાયોલીન                                      બ) ગિટાર

ક) પિયાનો                                      ડ) સિતાર

૪. ભારતીયપરંપરામાં મુખ્યત્વેકેટલારસનીવાતકરવામાંઆવીછે?

અ) ૫ બ) ૭

ક) ૧૧ ડ) ૯

૫. કર્ણાટકમાંકઈભાષાબોલવામાંઆવેછે?

અ) તમિલ બ) તેલુગુ

ક) ગુજરાતી ડ) કન્નડા

૬. કયોસિદ્ધાંતજણાવેછેકેક્રિયાઓનુંપરિણામ આજીવનમાંઅથવાભવિષ્યનાજીવનમાંભોગવવું જ પડેછે?

અ) આત્મ બ) સંસાર

ક) ભક્તિ ડ) કર્મ

૭. કયોગ્રંથકુરુક્ષેત્રનાયુદ્ધનુંવર્ણનકરેછે?

અ) રામાયણ બ) ગરુડપુરાણ

ક) ઋગ્વેદ ડ) મહાભારત